

# હાલરડાં

આવૃત્તિ : પહેલી 1928, બીજી 1929, ત્રીજી 1942, ચોથી 1955, પાંચમી 1980,  
પુનર્મુદ્રણ 1993, છઠી 1998  
સમગ્ર મેઘાઙ્ગી સાહિત્યના ગ્રંથ 'લોકગીત સંચય'માં 2014

## નિરેદન

આમાંના કેટલાંક હાલરડાં 'રહિયાળી રાત' (ભાગ 2)માં બહાર પડેલાં છે. બીજાં કેટલાંક જુડી આવ્યાં તે ભેળવીને આ અલાયદો સંગ્રહ કરેલ છે. અલાયદો સંગ્રહ એ હેતુથી કે એક સ્વતંત્ર વિષય તરીકેની એની મહત્ત્વા બતાવી શકાય; અંગ્રેજી, મરાઠી, સંસ્કૃત વગેરે હાલરડાંની સાથે સરખાવી રેનો તુલનાત્મક પ્રવેશક આપી શકાય; તથા હાલરડાંની ધારા વહેતી રાખવાની અગત્ય સમજાવી શકાય.

આજે માતાઓ નવાં હાલરડાં મારો છે, જૂનાંને વીસરી ગઈ છે. એ વિસ્મૃતિ ટળો અને નવાં રચવાની પ્રેરણા કોઈ માતૃપ્રેમી કરીને મળો!

એક બીજો આશાય એ હતો કે નજીવી કિંમતે આવી રમકડા જેવી નાની સ્વતંત્ર પુસ્તિકાને આપણી માતાઓ-બહેનો જલદી જરીદી શકે અને સહેલાઈથી વાપરી શકે. ન્રાણેક ગીતો હાલરડાં નથી, પણ સરતચૂકથી સંગ્રહમાં પેસી ગયાં છે.

ગુજરાત : 1-6-'28

અવેરચન મેઘાળી

[બીજી આવૃત્તિ]

આ રમકડા જેવી ચોપડીનો ત્વરિત સત્કાર થયો તે બદલ લોકસાહિત્યના પ્રેમીઓનો આભાર માનું છું.

તાજેતરમાં મુંબઈ ખાતે મારી જે વ્યાખ્યાનમાળા ચાલે છે તેના પ્રથમ વ્યાખ્યાન માટે 'હાલરડાં તથા બાલગીતો'નો વિષય મેં રાખેલો હતો. તેને અંગે વિધવિધ ભાત્યનાં બાલગીતોની મીમાંસામાં મારે ઉત્તરવું પડ્યું હતું. એ દોહનને પરિણામે હું તરતમાં જ આપણાં બાલ-જોડકણાં ('નર્સરી રૂહાઈમ')નો એક નાનો સંગ્રહ, એના તુલનાત્મક પ્રવેશક સહિત, પ્રકટ કરવાની સ્થિતિમાં છું. જીવન-કાવ્યના પ્રથમાંકુરો કચ્ચાંથી ને કેવી રીતે ફૂટે છે તેની સમજ વાચકગણને એ ચોપડીમાંથી મળી શકશે. બાળકોને તો બહુ ગમશે.

વસંતપંચમી : 1929

૩૦ મે

લોકગીતોના નક્ષત્રમંડળમાં હાલરડાં અને બાલગીતોનું નાનકડું જૂમખું શીતળ તેજે ચમકી રહ્યું છે. એની શોભા એની સાદાઈ અને સુધરતામાં જ રહેલી છે. એનો અલાયદો સંગ્રહ મેં બાળપ્રેમીઓની ઇચ્છાથી ચૌદ વર્ષ પર ગોઠવી આપ્યો હતો.

આ ત્રીજ આવૃત્તિ કરતી વેળા નવેસર શ્રમ લઈને મેં જેને હાલરડાં ન કહી શકાય તેવાં લાગેલાં પાંચ ગીતોને બાદ કરી દઈને નવાં શુદ્ધ હાલરડાં ઉમેરેલ છે. સૂરત બાજુના નમૂનાઓ મેં સ્વ૦ રણજિતરામે સંગ્રહેલ 'લોકગીત'માંથી, સ્વ૦ મહીપતરામકૃત નવલકથા 'વનરાજ ચાવડો'માં એમજે વાપરેલાં લોકગીતોમાંથી તેમ જ સ્વ૦ નમિટ સંગ્રહેલ 'નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતો'માંથી મૂકીને અન્ય સોરઠી હાલરડાં સાથે એનું સામ્ય તેમ જ વૈવિધ્ય સમજવાની સગવડ કરી આપી છે.

આમાંનાં ત્રણ પારસી, હિન્દુસ્તાની, તેમ જ મહારાષ્ટ્રી હાલરડાંની પ્રાપ્તિ તો ઐતિહાસિક છે ! 1929ના ફેબ્રુઆરીમાં જ્યારે હું સ્વ૦ ડૉ. જીવણજી મોદીના પ્રમુખપદે શાનપ્રસારક મંડળીના ઉપક્રમે મુંબઈમાં સર કાવસજી જહંગીર હોલમાં એક વ્યાખ્યાનમાળા આપી રહ્યો હતો, તે વખતે 'હાલરડાં ને બાલગીતો'ના ઉઘડતા જ વિષયમાં રસ પામેલાં શ્રીમતી ધનબાઈ બમનજી વાડિયા નામનાં અજાણ્યાં અજાણીઠાં એક પારસી બહેને ડૉ. જીવણજી મોદી પર પોતાની લખેલી એક નોટબુક મોકલેલી, તેમાં જૂનાં-નવાં કેટલાંક હાલરડાં હતાં. એ બહેનની સૂચના મુજબ સ્વ૦ ડૉ. જીવણજીએ મને એ નોટ નીચેના કાગળ સાથે મોકલી :

"આ સાથે કેટલાંક પારસી ગીતોની હસ્તપ્રત મોકલું છું તેમાં કદાચ આપને રસ પડશે. આપના વ્યાખ્યાનમાં શ્રીમતી ધનબાઈજી બમનજી વાડિયાને રસ પડવાથી તેમજે તે મારી ઉપર મોકલી હતી. એનો ઉપયોગ કરી લીધા પછી મને તે પાછી મોકલાવશો."

આ કાગળ અને નોટ, મારી પાસે આટલાં વર્ષ - બરાબર તેર વર્ષ ! - મારી હસ્તપ્રતોના જીર્ઝ થોકડા સાથે સલામત પડ્યાં રહ્યાં છે તેની મને પોતાને પણ હમણાં જ જબકતી જાણ થઈ.

હું મારા સદ્ગ્રામ માનું છું કે મારા અભ્યાસજીવનના એક સુંદર સોપાન સમી એ યાદગાર વ્યાખ્યાનમાળાના પ્રણેતાની તેમ જ એ દિલસોજ અજાણ્યાં પારસી બાનુની સ્મૃતિ આ રીતે મારી પાસે સચવાઈ રહીને અત્યારે હવે આ પુરીતિકામાં અંકિત બને છે. આ બહેનની નોટમાંના ત્રણ નમૂના ઉપાડીને, મને જરૂરી ભાસેલી પાઠશુદ્ધિ કરીને, મૂકું છું અને મને ખબર નથી, ખાતરી નથી, કે એ બાનુને આ પહોંચશે ! - એમનું ઠેકાણું આજે તેર વર્ષ આ પૃથ્વી પર કોણા જાડો કર્યાં હશે !

## વાત્સલ્યના સૂરો

('હાલરડાં'નો પ્રવેશક : 1928)

સાવ રે સોનાનું મારું પારણિયું  
ને ધૂઘરીનાં ધમકાર, બાળા પોઢો ને!  
ચાર પાયે ચાર પૂતળિયું  
ને મોરવાયે બે મોર, બાળા પોઢો ને!

કઈ શુભ ઘડીએ પ્રભુએ માતાના દેહમાં બાળક મેલ્યું, વિશ્વકર્માએ સુતારની કલ્યનામાં  
પારણું મેલ્યું, અને સરસ્વતીએ કવિના કંઠમાં હાલરડું મેલ્યું!  
એ ત્રણેય નાનકડી કૃતિઓમાં ઈશ્વરી સૃજનકલાનો મોટો વિજય અંકાયો છે. ત્રણેયના  
સમુચ્ચ્યયમાં એક સિદ્ધિનું દર્શન થાય છે. ત્રણમાંથી એક લઈ લ્યો અને આખી કૃતિ ખંડિત  
લાગે છે. ત્રણેયનો સામટો સંયોગ આપણા ઘરસંસારને અનેરી શોભા, અનોખી મીઠપ  
આપે છે. જનેતાનું જીવન જીવવા જેવું - દુઃખોના મોટા જૂથની સામે પણ મીઠાશથી જીવવા  
જેવું - બને છે. ગૃહજીવનમાં અને દંપતીસંસારમાં એ અમૃત સીંચે છે. બાળકના કૂણા  
જેવું : એ પતિ તરફના હેતમાં નવું પોષણ ટપકાવે છે. લગ્ન-જીવનની શરૂઆતમાં ફાટ!  
હાલરડું : એ પતિ તરફના હેતમાં નવું પોષણ ટપકાવે છે. લગ્ન-જીવનની શરૂઆતમાં ફાટ!  
ફાટ! થતો દંપતી-પ્રેમ સંસારના ટાઢા પવન પછી જ્યારે થીજુ જાય છે, ત્યારે ફરી વાર  
એને ઓગાળી પ્રેમનાં વહેન સ્થિરગતિએ વહાવનાર સૂર્યકિરણો આ ત્રણ છે : બાળક,  
પારણું અને હાલરડું. એને કોઈ અપમાનશો મા! અવગણશો મા!

બાળકનું નવ મારીએ રે  
પારણાનો રખેવાળ મારા વા'લા

પારણે બાળક જીવાવતી માતા જાણો કે આ તોઝાની 'પંચ મહાભૂત' બાળકને બ્રહ્માંડ-  
પારણામાં હીંચોળતી જગજજનનીનું નાનું-શું સ્વરૂપ છે, આછેરું પ્રતિબિભબ છે. રડતા ને  
પછાડા મારતા આ વિશ્વ-પ્રાણને વિરાટ પારણામાં હીંચતા બે ઘડી શાતા વળે છે. એનું  
નયન બે ઘડી નિદ્રામાં બિડાય છે. જગદમ્બા જાણો એને જુંપાવવા માટે આ વાયુ, વર્ષો,  
સુગંધો અને સુસ્વાદોરૂપી સૂરોનું હાલરડું જ નિરંતર ગાઈ રહી છે.

એ હાલરડાંના સૂર આ પૃથ્વીને આરે ઉત્તર્યાં. શિષ્ટ ગણાતી યુરોપીય જનેતા અને  
કાલીધેલી મનાતી છિન્દી માતા, બન્નેના કંઠથી હાલરડાં ઉઠ્યાં. શબ્દો જુદા, પણ સ્વરો  
એક જ સરખા :

હાલાં વાલાં  
 હા.... હાલાં!  
 ઓળોળોળો હાં ..... હાવાં!  
 ઓળોળોળો હાત્ય હાલૂડા હાત્ય!  
 એ ગુજર સૂરો : તેની સામે મૂકો યુરોપી સૂરો :

*Below, la-low!*  
*Lulla la lulla, Iulia, lullaby!*  
*Shu heen Sho, Iulo lo!*  
*O ho ro, i ri ri, csdul gu lo!*

સર્વમાં એક જ લહેડો : એક જ પોઢણ-સ્વર : કેમ કે માતૃત્વ એક જ છે. જાતિના લેદો અને કદી રૂધી શકશે નહિ. બાળક સર્વત્ર એક જ અને લેદરહિત છે. જગતની નિર્દોષમાં નિર્દોષ કૃતિ તે બાળક છે. જગતનું મહાપુણ્ય તે અનું લાલનપાલન છે. પારણું અને હાલરડું એ લાલનનાં નિર્દોષ સાધનો છે.

### હાલરડાનો પ્રથમ જન્મ

આપણે ત્યાં કૃષણની બાળ-લીલા : અને યુરોપમાં ઈસુના શૈશવ-ખેલ : બન્નેમાંથી માતાઓએ વાત્સલ્યનાં પોષણ લીધાં. બન્ને દ્વારા બાળક પ્રભુના ભુવન સાથે જોડાયું. હિન્દુ માતાઓને કનૈયાનું બાલસ્વરૂપ જેટલું સ્પર્શી શક્યું છે તેટલાં એનાં અન્ય સ્વરૂપો નથી સ્પર્શ્યાં. કૃષણ એટલે એક આદર્શ બાળક : દેવમંદિરમાં રોજ રોજ એના હીડોળા હીંચોળાય છે. પારણાં ઝુલાવાય છે. વૈષ્ણવોને વહાલામાં વહાલી મૂર્તિ ધૂંટણભર ચાલતા બદુકડા લાલજી મહારાજની છે. અને એ બાળગોપાળ એટલે ગરીબમાંથે ગરીબ માતાનો બેટડો : એની કીડા, એની લીલા, એની માખણચોરી, દોણીઝોડની મસ્તી, થેઈ થેઈ પગલીઓ, આકાશી તારાનાં રમકડાં ઉતારવાની માગણી! એ બધા શિશુખેલ, રાયથી રંક સુધી સમસ્ત ઘરોનાં બચ્ચાંમાં સ્વયંસ્કૃતિત હોય છે. માટે જ કૃષણની બાળલીલાનાં ગાન તે તમામ બાળકોની બાળલીલાનાં ગાન છે. માટે જ આપણાં ઘણાંખરાં લોક-હાલરડાં કૃષણે સંબોધી ગવાયાં છે.

જૈનોમાં પણ તીર્થંકરોની માતાનાં ગર્ભાધાન, ગર્ભિણી માતાનાં સોળ સ્વન્જાં, બાલ તીર્થંકરનો જન્મોત્સવ, એનાં ગીતો વગેરે વધુ મહિમાવંત હોય છે. ત્રિશલ્યાના કુમાર મહાવીરનાં હાલરડાં હોંશે હોંશે ગવાય છે.

અને ઈસુ પણ જાણે બાળકોના જ ઉદ્ધાર માટે આવ્યો હતો. એ તારણહારને મોટી વયે પણ બચ્ચાંઓ જ વધુ વહાલાં હતાં. ‘સફર લીટલ ચીલ્ડન ટુ કમ અન્ટુ મી’ (નાનાં બચ્ચાંને મારી નજીક આવવા દેજો!) એ અનું મહાકાવ્ય મનાયું છે. અને જેમ માઈકલ એંજેલો, રાફેલ ઈત્યાદિ કલાધરોએ કુમારી માતા મેરીનાં ખોળામાં ખેલતા બાલ-ઈસુની કલ્યાનાને ઉત્કૃષ્ટ રંગે રંગી ચિત્રપટ પર ઉતારી છે, તેમ ત્યાંના કવિઓએ પણ કરુણ સ્વરે એ બાલપ્રભુનાં હાલરડાં ગાયાં છે. જેમ એક કૃષણનો અવતાર ટાળવા માટે મામા કંસે દેવકીજીનાં તમામ બચ્ચાં મારવાનો આદેશ દીધેલો, તેમ એક ઈસુનું અસ્તિત્વ રદ કરવા માટે રાજા હેરોડે પ્રજામાં નવાં જન્મતાં એકોએક બાળકને હણવાની આજ્ઞા ફેરવેલી. પાપી

રાજાનો નાશ કરનાર બાલ રાજેન્દ્ર જન્મયો છે, છૂપો રહેવા માગતો નથી, મોટે સુરે રૂઢું છે, અને માતા મેરી એને ફોસલાવે છે કે -

*My sweet little baby, what meanest thou to cry?*

*By still my blessed baby, though cause thou hast to  
mourn,*

*Whose blood most innocent to shed the cruel king has  
sworn*

*And lo! alas! behold what slaughter he doth make,  
Shedding the blood of infants all sweet Saviour for thy  
sake.*

*A king, a king is born, they say, which king this king  
would kill,*

*O woe and woeful heavy day when wretches have their will!*

*Lulla, la lulla, lulla, lullaby.*

મારા ધ્યારા નાના બાળક, શીદ રે છે તું?

ચૂપ રહે, પ્રભુના ધ્યારા;

જોકે રડવાનું તને કારણ છે.

રાજાએ તારું નિર્દોષ લોહી રેડવાના શપથ લીધા છે.

હાય રે! શી કતલ એકો આદરી છે!

એક તારે ખાતર, ઓ તારણહાર! તમામ બચ્ચાનાં લોહી રેડાય છે.

લોકો બોલે છે કે એક રાજેન્દ્ર જન્મયો છે, જે આ રાજાને મારશે.

ઓ નાથ! કેવો હુદ્દિન! પાપીઓ સ્વરંદે મહાલે છે.

લલ્લા! લા લલ્લા! લલ્લા લલ્લેબી!]

આપણા બાળ-કૃષણને પણ માતાએ એ જ અર્થનાં હલાં ગાયાં કે

રો મા! રો મા! રે બાળક!

બારણે બેઠું છે હાઉ

બારણે બેઠું છે હાઉ.

અંગ્રેજ કવિ, જનેતાના સૂરો કાઠીને પુનઃ પણ એ જ 'તારણહાર'નાં સંભારણાં હાલરડે

ગાય છે કે -

*Sweet baby in thy face*

*Holy image I can trace;*

*Sweet baby, once like thee*

*Thy maker lay and wept for me.*

મધુર બાળક! તારી મુખમુદ્રામાં હું એ પવિત્ર આદૃતિ નિહાળું છું, ઓ મીઠા બચ્ચા! તારી માફક  
એક વાર એ સરજનહાર પણ સૂતો હતો ને મારે માટે રડતો હતો.]

*Wept for me thee, for all*

*When he was an infant small.*

*Thou his image ever see,*

*Heavenly face that smiles on thee.*

[મારે, તારે અને સહુને માટે એ રડચો હતો, જ્યારે એ નાનું બાળક હતો ત્યારે. એ દિવ્ય વદન  
તારી સામે મલકી જ રહ્યું છે. તું નિરંતર એને નીરખતો જ રહેજો!]

*When God with us was dwelling here,*

*In little babes he took delight*

*Such innocents as thou, my dear!*

*Are ever precious in his sight :*

*Sweet baby then, forbear to weep*

*Be still my baby, still baby sleep!*

પ્રભુ જ્યારે આંધીં આપણી સાથે વસતા હતા, ત્યારે એને નાનાં બચ્ચાંમાં આનંદ પડતો. મારા  
વાંલા! તુજ સરખાં નિર્દોષ એની નજરે મહામૂલાં દીસતાં. માટે, ઓ મધુર બાળક! રો નહિ. છાનું રહે!

કવિ આગળ ગાય છે કે એ બાળપ્રભુને માટે તો આંધીં તારા જેવાં પારણાંયે નહોતાં,  
નહોતાં હીરચીર, કે નહોતાં હુંફાળા ખોરડાં. એ તો અવતરેલા તબેલામાં : એનાં એવાં  
કષ્ટોને પરિણામે જ આજ તને આ સુખવૈભવ સાંપડ્યાં છે. ઓ મધુર બાળક! છાનું રહે!]

### સમાન સૂરો

સૂઈ જા, વીર, સૂઈ જા!

લાડકડા વીર સૂઈ જા!

તને રામજી રમાડે

વીર સૂઈ જા

તને સીતાજી સુવરાવે

વીર! સૂઈ જા!

[‘રઢિયાળી રાત’]

એ આપણાં હાલરડાંની પંક્તિઓ : એ જ કલ્યના પશ્ચિમમાં ઉદ્ભવી કોઈ મહાન  
કવિના પ્રાણમાં :

*Hush! my dear, lie still and slumber*

*Holy Angels guard thy bed*

*Heavenly blessing without number*

*Gently falling on thy head!*

[ચૂંધ, મારા વખલા! શાંત પડીને પોઢી જા. પુનિત દેવતાઓ તારી પથારી રક્ષે છે. તારા મસ્તક  
પર સ્વર્ગથી અનંત આશિષો જરે છે.]

‘હોલી એન્જલ્સ ગાર્ડ ધાઈ બેડ’ : તને રામજી રમાડે : તને લક્ષ્મણજી લડાવે! તને  
સીતાજી સુવરાવે! એકની એક વાત : એકનું એક હદ્ય : ગૌરવરણું ને કાળું : ચકમકતાં  
સોનેરી જુલ્દાંવાળું કે સીંદરી જેવા વળ દીધેલા વાળવાળું : એવા ભેદ એ પ્રભુની બનાવટમાં  
નથી, પારણાના ઝૂલનમાં નથી, કે માતરાનાં હાલરડાંમાં નથી.

અંગ્રેજ કવિ શેક્સપિયરે કાવ્યભરી અને ભાષાની ભળકભરી જોઈ વાણીમાં બાળ  
ગુંચોળું કે -

You spotted snakes with double tongue  
Thorny hedgehogs, be not seen;  
Newts and bline-worms do no wrong,  
Come not near our fairy queen.  
Philomel, with melody  
Sing in our sweet lullaby  
Lulla, lulla, lullaby;  
Lulla, lulla, lullaby .

[બે-જીભાળ કાબરા સરપો! કંટાળા શેળાઓ! ન નીકળતા, અમારી પરી રાણી પાસે ન આવતા,  
ઓ બુલબુલ! મીઠી હલકે તું બેનબાનાં હલાં ગાજે!]

એ જ ભાવ, સાદા, અણખીલ્યા, અર્ધવ્યક્ત સ્વરૂપમાં ગુજરાતી લોક-માતાએ ગાયો :

હડય તૂતૂડાં હાંકું,  
ભાઈને રોતો રે રાખું!  
તૂતૂડાં જાજે દૂર,  
ભાઈ તો શિરાવશે દૂધ ને ફૂર :  
દૂધ ને ફૂર લાગે ગળ્યાં  
ભાઈના આત્મા રે ઠયાર્યાં.  
હડય તૂતૂડાં હસજો!  
વાડીમાં જઈને રે વસજો!  
હા....હાં હલાં!

[‘રઢિયાળી રાત’]

### સ્વર્ણાં

જૂનાં લોક-હાલરડાંમાં સ્વર્ણાંની કલ્યના બહુ ખીલેલી જ નથી. કેવળ એક જ  
ગીતમાં -

નીંડરડી તું આવે જો આવે જો  
મારા બચુ તે ભાઈ સારુ લાવે જો - નીંડરડીં  
તું બદામ મિસરી લાવે જો - નીંડરડીં  
તું પેંડા પતાસાં લાવે જો - નીંડરડીં

એવું ફક્ત મીઠા ‘ખાઉ ખાઉ’નું જ અસ્યાસ સ્વર્ણ લાવવાનું નિદ્રાને સંબોધન થયું.  
અંગ્રેજ કવિ યુછન ઝીલે આ કલ્યનાને સુરેખ બનાવીને આલેખી : જાણે અબોલા  
નગરીમાંથી નીંડરપરી સ્વર્ણો લઈને ચાલ્યાં આવે છે!

The Rock-a-by, Lady from Hush-a-dau street  
Comes stealing : comes creeping :  
The poppies they hang from her

*head to her feet  
 And each hath a dream that is  
 tiny and fleet  
 She bringeth her poppies to you, my sweet :  
 When she findeth you sleeping!*

[અબોલા નગરીમાંથી હુલાવણ-પરી ચાલ્યાં આવે છે : છાનાંમાનાં, લળતાં, નમતાં, ચાલ્યાં આવે છે. એના પગથી માથા લગી ફૂલો ઝૂલે છે તે પ્રત્યેકમાં અક્કેક નાજુક મીઠાં સોણલું છુપાયું છે : તને એ જ્યારે પોઢેલો દેખશો, ત્યારે, ઓ મારા મીહુડા! આવીને એ તારી હથેજીમાં આ સોણાભયાં ફૂલો મેલી જશો.]

*There is one little dream of a beautiful drum  
 'Rub-a-dub'! it goeth :*

*There is one little dream of a big sugar-plum,  
 And lo! thick and fast the other dreams come  
 Of popguns that bang, and tin-tops that hum  
 And a trumpet that bloweth.*

[એક સોણું તો છે રૂપાળા હોલકાનું : ડબૂક! ડબૂક! એ તો વાગે છે : બીજું છે મોરા ગુલાબજાંબુનું અને ઓહોહોહો : બીજાં કેટલાંય સોણાં! ભાડિંગ કરતી બંદૂકનાં, ભમ ગાજતા ગરિયાના અને ભોં પોં પો વાગતા રણશિંગાના - બધાં દોડચા જ આવે છે.]

આથી વધુ કવિત્વભયું સ્વાન-હાલરંગું શ્રીમતી સરોજિની નાયડુએ ગાયું છે :

*From groves of spice  
 O'er fields of rice  
 athwart the lotus-stream,  
 I bring for you,  
 aglint with dew,  
 a little lovely dream.*

[સુગંધી તેજાનાના બગીચામાંથી, ડાંગરના જેતરમાંથી અને કમળખીલ્યા ઝરણમાંથી હું તારે માટે એક ઝાકળભીનું મીઠું સોણલું લાવું છું, બેટા!]]

*Sweet, shut your eyes!  
 The wind fire-flies  
 Dance through the fairy neem.  
 Form the poppy hole  
 For you I stole  
 A little lovely dream.*

[ઓ ઘારા! આંખો મીંચી ટે. સુંદર લીંબડામાં આગિયા નાચે છે. ખસખસનાં ફૂલોમાંથી હું તારે માટે એક સોણલું ચોરી લાવી છું.]

*Dear eyes, good-night!  
 In golden light  
 The stars around you gleam.  
 On you I press*

*with soft caress*

*A little lovely dream.*

[આવજે! ઓ સુલોચન! કનકવરણા તેજમાં તારી ચોપાસ ચાંદરડાં ચળકે છે. તારા છોટ ઉપર  
કુષ્ણી બચ્ચી વાટે હું નાનું રૂપાણું સોણું ચાંપી દઉં છું.]

આવું કલ્યના-ભુવન બેશક લોક-હાલરડાંમાંથી નથી, તેમ શિષ્ટ કવિની કવિતામાં  
પણ ગુજરાતને સાંપડ્યું નથી. ગુજરાતી કવિતાઓને બાળકની કીડામાં, બાળકની નિદ્રામાં,  
એની મીંચાયલી પાંપણોમાં અને શાંત સૂરેલી મુખમુદ્રામાં કાવ્યત્વનું દર્શાન નથી થયું.  
ગુજરાતી કાવ્યદેવીના અંતરમાં વાત્સલ્યના સૂરો ઝાજા નથી ઉઠ્યા. હાલરડાં ગાવાનો  
સુમય હજુ એને આવવો બાકી છે!

### યુરોપીય હાલરડાંનો પ્રવાહ

ગુજરાત વાત્સલ્યવિહોણું નથી, પણ એના કાવ્યવિહોણું લાગે છે, નહિ તો બાળકનાં,  
પારણાં આજ ઉદાસ, અભોલ અને કેવળ લાકડાંના માળખાં જ ન બની ગયાં હોત : પારણાંની  
દોરી બેતાલ ન ખેંચાતી હોત : કળિયાળા બાળકને માતા મારી પીઠી, હચમચાવીને ન પોઢાડતી  
હોત. જુનાં લોક-હાલરડાંમાં એકસૂરીલાપણાનો ('મોનટોની'નો) કંટાળો અનુભવતી આ યુગની  
તરુણ જનેતાઓ પાસે નવા રસે છલકતી, નવી ઊર્મિને ધબકારે ધબકતી, નવી કલ્યના-કળીએ  
મહેકતી હાલરડાંની કવિતા નથી. આપણાં લોક-હાલરડાંનો પ્રવાહ આગળ ન વધી શક્યો;  
કેવળ કૃષ્ણનાં સોનારુપાનાં પારણાં અને દૂધદહીનાં ખાનપાન અથવા મામા કંસના સંહાર  
વિશેના થોડા નાજુક સ્વરોમાં રૂંધાઈ ગયો. ત્યાંથી વહનને આગળ ચલાવે તેવી કોઈ મેઘધારા  
ગુજરાતી કવિઓના કંઠમાંથી વરસી નહિ ... નહિ તો,

તમે મારા દેવના દીધેલ છો  
તમે મારા માગી લીધેલ છો  
આવ્યા ત્યારે અમર થઈને રો!  
તમે મારું નગદ નાણું છો  
તમે મારું ફૂલ વસાણું છો  
આવ્યા ત્યારે અમર થઈને રો!

<sup>1</sup> સ્વખાનાં હાલરડાં રચવાના થોડા પ્રયાસો મેં કર્યા છે :

### 1. નીંદરભરી

નીંદરભરી રે ગુલાલે ભરી  
બેનીબાની અંભિયાં નીંદરભરી રે  
['વેણીનાં ફૂલ']

### 2. સોજાલાં

સોજાલાં લાવે રે, સોજાલાં લાવે રે  
વીરાને પારજો જીલાવા  
નીંદરડી સોજાલાં લાવે રે  
['કિલ્લોલ']

- એવા લોક-વાત્સલ્યના ઉમદા ઉચ્ચારણમાંથી શિષ્ટ કવિઓને નવી પ્રેરજા મળી ગઈ હતે. પુરોપમાં નવયુગી કવિતાને વંધ્યત્વ નથી પાલવું. સંતતિ-નિયમનના પ્રથમ સૂરો કાઢનાર એ પ્રદેશમાં, સભામાં જવા માટે જ્યાં બાળકો આયાને હવાલે સૌંપાય છે તે ભૂમિમાં, કેવી મીઠી હલકે બાલપ્રેમની ગાથાઓ ગવાઈ! આપણાં જ હાતરડાં જેવું એનું એક લોક, હાલરકું લઈએ :

*My little sweet darling, my comfort and joy,  
sing lullaby, lulla.*

*In beauty surpassing the prince of Troy  
sing lullaby lulla.*

એ લોક-સૂરોનો એની નરી સાદાઈને કારણે વિનાશ નથી થયો. એમાં જ કલમ બોળીને કવિએ નવયુગના ઉદ્ગારો ગાયા કે -

*So fair, so dear, so warm upon my bosom*

*And in my hands the little rosy feet.*

*Sleep on, my little bird, my lamb, my blossom!*

*Sleep on, sleep on, my sweet.*

[શાં રૂપાળાં, શાં ઘારાં, શાં હુંફાળાં એ અંગો મારી છતી પર પડ્યાં છે! ને મારા હથમાં એના કેવા ગુલાબી નાનાં ચરણો રમે છે! ઓ મારા પંખીડા! મારા મેંગા! મારા હૈયા પર સૂતું રહે. સૂતું રહે, ઓ મધુર! સૂતું રહે.]

*Dear Lord, 'tis wonderful beyond all wonder,*

*This tender miracle vouchsafed to me,*

*One with myself, yet just so far asunder,*

*That I myself may see.*

[ઓ ઘારા પ્રભુ! આ તો એક ચમત્કાર છે. તાજુબી છે. મારી સાથે એકમેક, ને છતાંથે અલાયદું પાડ્યું છે કે જેથી હું મારા જ એ સ્વરૂપને જોઈ શકું.]

*Mine, Lord, all mine thy gift and  
loving token.*

તમે મારા દેવના દીધેલ છે.

કેવું હૂબદ્દૂ મળે છે! અને તે પછી -

તમે મારું કૂલ વસાણું છે.

એની સાથે -

*Only a tender flower sent us to rear.*

એ પણ બરાબર મળે છે. ગુજરાતની અનામી, ઘેલી ગ્રામ્ય માતા, ને દ્રોગલન્ડની સુશિક્ષિત કવિમાતા મેથીઆજ બાર! બન્નેની વાણી એક છે. એક છે, કેમ કે એ વાણી વાત્સલ્યની છે.

બાળપાણનું રાજ્યાટ

બાળપાણા! બાળપાણા! એ બાળક માટેનું આપણું બહુ પરિચિત સંબોધન છે. પરંતુ

એ રાજના મહારાજ્યની કલ્યાણ આપણાને સાંપડી નથી. એ તો ચૂકી છે એક અંગ્રેજ  
જનેતાને : એનું નામ લોરેન્સ આત્મા : એષે હાલરડામાં બાળ-રાજનું રાજ્યાટ ગાયુઃ :

*King Baby on his throne*

*Sits reigning o! sits reigning o!*

*King Baby on his throne*

*Sits reigning all alone.*

[બાળરાજા તખ્ત પર બેઠા બેઠા રાજ કરે છે. એકલા, એકલા એ જ એના તખ્ત પર બેઠા છે.]

*His throne is mother's knee*

*So tender o, so tender o!*

*His throne is mother's knee*

*Where none may sit but he.*

[માતાનો ખોળો એનું સિંહાસન છે : ઓહો કેવું સુંવાળું એ સિંહાસન! એના વિના ત્યાં બીજું કોઈ  
નથેશે.]

અને એનો મુગાટ!

*His crown it is of gold*

*So curly o, so curly o!*

[ખીણા કનકવરણા કેશના ગુચ્છાનો એ મુગાટ! ઓહો, કેવા વાંકડિયા વાળ!]

ને એનું સાધ્રાજ્ય કર્યાં!

*His kingdom is my heart*

*So loyal o! so loyal o!*

[માતાપણું હદ્ય તે એનું રાજ્યાટ : કેવું રાજનિષ્ઠ!]

કોઈ ચક્રવર્તીને ન હોય તેવું. અને એના કાયદા? -

*Divine are all his laws*

*So simple o! so simple o!*

[ઈશ્વરી કાયદા! સાદા સરલ, સ્નેહનાં જ ધારાશાસ્ન!]

જેનો આખરી આશય - અને એનું આદિકરણ -

*With love for end and cause.*

[કેવળ સ્નેહ, કેવળ મમતા, અન્ય કશું જ નહિ.]

વ્યથાગ્રાહીતોનાં હાલરડાં

અંગ્રેજ હાલરડામાં તો કેવળ વિનોદ જ નહિ, કેવળ ખુશાલી નહિ, પણ વિધવા  
માતાનાં, ત્યજાયેલી-ઠગાયેલી જનેતાઓનાં પરદેશો પળેલા પિયુળીની વિજેગણ પત્નીઓનાં,  
આ કંઈ કંઈ મર્મગામી વ્યથાગ્રાહીતો પણ ગવાયાં છે. ભેદક સૂરે માતા બાળકને કહે છે  
કુ -

*Oh, Bonnie birdeen,  
Sweet bird of my heart!  
Tell me, o tell me,  
How shall we part?*

ઓ મીડા પંચી! મારા હદ્ય-માળના ઓ મધુર પંચી! કહે મને, આપણે કેવી રીતે વિભજા પણશો?

*He calls me, he cries  
Who is father to thee :  
O birdeen his eyes  
In these blue eyes I see.*

મને એ બોલાવે છે - તારો પિતા મને બોલાવે છે, ઓ પંચીડા! તારી આ આસમાની આંખોમાં  
હું એની આંખો લાડકતી દોષું છું.]

*Weep not my wanton, smile on my knee :  
When thou art old, there's grief enough for thee  
He must go, he must kiss  
Child and mother, baby bliss!  
For he left his pretty boy  
Father's sorrow, father's joy.*

ન રો મારા લાડકડા! મારા ખોળામાં હાસ્ય કર, મોટો થઈશ ને, ત્યારે તારે ઘણુંયે રોવાનું સાંપડશો  
હું!

બાળકને અને માતાને છેલ્લી ચૂમી ભરીને તારા પિતાને જવું પડ્યું, ઓ મારા વહાલા! એ તને  
- પોતાના હર્ષ-શોકના સાધનને - છોડીને ચાલ્યો ગયો!]

એથીય વધુ કલ્યનામય, વધુ તીવ્ર વધુ વથાજનક તો છે કોઈ સમુદ્ર નૌકા ખેડતા  
પિતાના પુત્રનું હાલરડું : શિયાળાની કોઈ અંધારી રાતે પ્રાણધાતક પવન ફૂકે છે, અને  
કૂબામાં જાંખો દીવો બાળતી જગત બેઠેલી વિજોગણ નાવિક-પણીના અંતરમાં સ્વામીના  
પ્રાણની રક્ષાની ચિંતા ફડફડે છે : એમાંથી દરે છે મીહું હાલરડું :

*You are rockin full sweetly on<sup>2</sup>  
mamie's warm knee.  
But daddie's a-rockin upon the salt sea.*

[ઓ બર્ચા! તું તો લહેરથી માડીના હૂંઝાળા ખોળામાં જૂલે છે, પણ તારા બાપુ તો અત્યારે ખારા  
સમુદ્રને ખોળે હશે, વહાલા!]

<sup>2</sup> મારો પ્રયાસ આ ભાવને ઉત્તરવાનો આમ છે -

**હાલરડું વા'લું**

વાલીડા વીરને હાલરડું વા'લું  
હૈયાના હીરને હાલરડું વા'લું  
તને દેખાડું સોણલું રૂપાણું હે  
વીરને હાલરડું વા'લું.

→

\*

*The wild wind is ravin and mammie's heart's sair  
The wild wind is ravin, and ye dinna care.*

[તોશની પવન ફૂકે છે, અને માવડીનું અંતર બળે છે. છતાંયે બચ્ચા! તને મારા હદ્દણી કરો!  
જેવના નથી. તું તો રક્યા જ કરે છો!]

આવી કોઈ પંક્તિઓ ગુજરાત ક્યારે બતાવી શકશે? મધ્યસાગરે સાહસ જેડતા  
ખારવાનાં કે કાળી મેઘલી રાતે કુંગરામાં ગાયો ચારતા ગોવાળ ચારણોનાં નાનાં બચ્ચાંને  
પોઢાડવા મથતી ગરીબ માતાઓનાં અંતર ઉકેલવા, એની મધુર વથાને કાવ્યમાં આલેખવા  
ગુર્જર કવિતા ચાલી આવે છે.

આગળ ચાલીએ : હાલરંગું જાણો કે પ્રાર્થના બની જાય છે :

*Sweet and low, Sweet and low,  
Wind of the western sea,  
Low, low, breathe and blow,  
Wind of the western sea!  
Over the rolling weters go,  
Come from the dying moon and blow,  
Blow him again to me :  
While my little one, while my pretty one sleeps.*

[ધીરે ધીરે, ધીરે ધીરે ઓ આથમણા સાગરના વાયુ! ધીરે વાજે! ધીરી લહરે વાજે! આથમતા  
ચંદની અંદરથી જલદી ઉત્તરજે. અને મારું લાડકવાયું બચ્ચાનું હજુ તો પોઢેલું હોય ત્યાં જ તું એને -  
મારા નૌકાવિહારી પ્રિયતમને - આંદીં પહોંચાડી દેજે, ઓ પશ્ચિમના વાયુ!]

તારાં પોઢણ લાલ હીંગોળે પારણે  
પીવાનાં દૂધ તારે મીઠાં રે  
બાપુને આજ મેં તો ભૂખ્યા ઉજાગરે  
ધુમના સાગરમાં દીઠા. - હો વીરને૦  
[‘કિલ્લોલ’]

<sup>3</sup> મેં આ સૂરોમાંથી ગુજરાતીમાં ખેંચેલ છે :

### ખલાસી બાળનું હાલરંગું

ધીરા વાજે રે ધીરા વાજે !  
વાહુલિયા રે ધીરાધીરા વાજે !

\*

મીઠી લેરે મધ્યદરિયે જાજે,  
સ્વામી કેરા શઠની દોરી સ્થાજે,  
અાકળિયા નવ રે જરી થાજે - વાહુલિયા રે૦

[‘કિલ્લોલ’]

*Sleep and rest, sleep and rest,  
Father will come to thee soon;  
Rest, rest, on mother's breast.  
Father will come to thee soon;  
Father will come to his babe in the nest  
Silver sails all out of the west  
Under the silver moon.*

*Sleep, my little one, sleep, my pretty one sleep.*

[પોઢી જા ને વિસામો દે! તારા બાપુ હવે જલદી આવશે. માડીની છતીએ વિસામો દે! તારા બાપુ હમણાં જ આવશે. રૂપલાવરણા ચંદ્રને અજવાળે, રૂપલા ધોળા શહે ફરકાવતા તારા બાપુ પચ્છિમમાંથી ચાલ્યા આવે છે. તારી પાસે આ નાના કૂભામાં ચાલ્યા આવે છે.]

એ નાવિક-બાળનું હાલરડું ગાનાર અંગ્રેજી કવિવર ટેનિસન. ફક્ત વિધવા નહિ, ફક્ત વિજોગણ નહિ, પણ ફસાયેલી માતાનું વાત્સલ્ય પણ ત્યાંના કવિઓએ અનુકૂળ્યાના તાર પર ચડાવી કરુણ સૂરે ગાયું છે. કવિતાના પુનિત નીરમાં નવરાવી એ માતૃપ્રેમને નિષ્પાપ બનાવેલો છે અને હાલરડા વાટે નિર્દ્દ્ય લંપટ પુરુષ પ્રતિ ઊરી આહ સંભળાવી છે :

*Come little babe, come silly soul,  
Thy father's shame, thy mother's grief.*

[આવ, નાના બચ્ચા! આવ, નાદાન આત્મા! તારા પિતાની લંજા! તારી માતાની વેદના! આવ!] *Thou little thinkest, and less dost know,  
The cause of this thy mother's moan.*

[તને વિચાર પણ નથી, બબર પણ નથી, કે મા શીદ કટ્યાંત કરે છે.]

*But come to mother, babe, and play,  
For father false is fled away.*

[પરંતુ મા પાસે આવ, બેટા, અને રમ્યા કર, કેમ કે તારો બેવજા બાપ તો ભાગી ગયો છે.]

*If any ask thy mother's name  
Tell her, by love she purchased blame.*

[કોઈ જો તારી માનું નામ પૂછે ને, તો કહેજે કે પ્રેમ આપીને એણે કલંક વહેયું છે!] *Ask blessings, babe, be not afraid,  
His sugared words have me betrayed  
God bless my babe, and lullaby  
From this thy father's quality.*

[પણ ચિંતા નહિ બચ્ચા! તું તો, બસ, સહુના આશરીવાંદ જ માગજે. એના સાકરિયા શબ્દોએ જ મને ફસાવી હતી. ઓ પ્રભુ! મારા બાળકને દુવા દેજો, પોગડજો, અને એના પિતાના જેવી લંપટતાથી એની રક્ષા કરજો!] *લોકગીત સંચય*

## વીરરસનાં હાલરડાં

અંગ્રેજુ કવિ વોલ્ટર સ્કોટે હાલરડાં વાટે માતાઓને તથા બાળકોને વીરરસ પાયો; પહાડો, કિલ્લાઓ, રણશિંગાં અને ઘમસાણોનાં દશ્યો બાળકનાં પારષાંની આગામાસ એથે ઉભાં કયો :

*O hush thee, my babie, thy sire was a knight;  
Thy mother a lady both lovely and bright.  
The woods and the glens, from the towers which we see.  
They all are belonging, dear babie, to thee.*

*O ho ro, i ri ri, candul gulo.*

[છાનો રહે, બચ્ચા! તારો પિતા સામંત હતો. તારી માતા એક તેજસ્વી સુંદરી હતી. આ કિલ્લાના બુરજ પરથી ટેખાતાં જંગલો ને આઈએ - બધાં તારાં જ છે, મારા ઘારા બચ્ચા!]

*O, fear not the bugle, though loudly it blows,  
It calls but the warders that guard thy repose.  
Their bows would be bended, their blades would be red,  
Ere the step of a foeman draws near to thy bed.*

[આ ઘોર સ્વરે રણશિંગનું બજે છે. પણ ડીશ ના. એ તો તારી પથારીના ચોકીદારોને જ બોલાવે છે. તારી શય્યા પાસે શત્રુનું એક પગલું પડે તે પહેલાં તો એ પહેરેગીરોનાં ધનુષ્યોની કમાનો ખેંચાઈ જશે ને એની તરવારો દુર્મનોનાં લોહીમાં લાલબંબોળ બનશે!]

અને, ઓ કુમાર! તારે જાગ્રી ઉઠવાનો સમય પણ હમણાં જ આવી પહોંચશે. આજ તો તું નીંદર કરી લે -

*O! hush thee, my babie, the time will soon come,  
When thy sleep shall be broken by trumpet and drum,  
Then hush thee, my darling, take rest while you may,  
For strife comes with manhood, and waking with day.<sup>5</sup>*

<sup>4</sup> વીરરસનાં હાલરડાં 'શિવાજુનું હાલરડું', 'વનરાજનું હાલરડું', 'સોષાલાં' વગેરે રચવાના મારા પ્રયત્નો 'કિલ્લોલ'માં છે.

<sup>5</sup> સરખાવો 'શિવાજુનું હાલરડું'માં -

પોઢજો રે મારાં બાળ, પોઢી લેજો પેટ ભરીને આજ  
કાલે કાળાં જુદ્ધ ખેલાશે, સૂવા ટાળું કવાંય ને રે'શે.

અને 'વનરાજનું હાલરડું'માં -

હાં રે વીરા, આજુની રાત, આરામ,  
હાં રે વાલા, આજુનો દિન વિશરામ,

કાલે ને કેસરિયા રે ખાંડાધારે ખેલજો હો રાજ !  
કાલે કંકુભરિયા રે અરીને તેડાં મેલજો હો રાજ !

['કિલ્લોલ']

આજે તો પોઢી લે, બચ્ચા! કેમ કે એ સમય જલદી આવી પહોંચશે, જ્યારે રણાંગણને પડ્યમણી તારી નિદ્રા ઉડી જશે. માટે આજે તો આરામ લઈ લે; કેમ કે સંગ્રામ આવે છે જુવાની બેસતાં, અને જાગૃતિ આવે છે દિવસ ઉગમતાં.)

કાઠિયાવાડ-ગુજરાતમાં ગઢો છે, કિલ્લા છે, સંગ્રામોના ને વીરમૃત્યુના દૃતિહસ છે. પરંતુ કોણ જાણે શા કારણે એ શૈર્યના સૂરો જૂનાં હાલરડાંમાં જાગ્યા નથી. ફક્ત કૃષ્ણજીવનમાંથી કાળીનાગના દમનના ને કંસવધના ક્ષીણ ધ્વનિઓ કુચાંક કુચાંક લોકમાતાઓના કંઠમાંથી નીકળ્યા છે :

ડોશી એમ કરીને મેણું બોલિયાં રે લોલ,  
તારા બાપનાં હતાં તે વેર વાળને રે લોલ.  
માડી અમને તે વાત કરી આલને રે લોલ,  
જાંબું મામાને ઘેરે મળવા રે લોલ.  
સાંકડી શેરીમાં મામો સામા મળ્યા રે લોલ,  
ભાડોજ દેખીને મામો સંતાઈ ગિયા રે લોલ.  
સંતા સંતા મા મામા મૂરખા રે લોલ,  
આપણે મામો-ભાડોજ બહુ મળીએ રે લોલ.  
હૈયું ભીસીને મામો ભાડોજ બહુ મળ્યા રે લોલ,  
તારા બાપનાં હતાં તે વેર વળી ગિયાં રે લોલ.

[‘રઢિયાળી રત’]

અથવા તો -

મા મને હાઉલું દેખાડય  
મા મને હાઉલું દેખાડય  
હાઉ છે લંકા લખેશરી!  
માડી, મને નવ જાણીશ નાનકો;  
કાલે મોટેરો થઈશ  
કાલે મોટેરો થઈશ  
વેરી મારીશ આપણા.

[‘રઢિયાળી રત’]

અથવા કદાચ બહુ તો -

પાતાળે જઈ કાના હાં હાં હાં  
નાથ્યો કાળી નાગ;  
વારિ ને વરમાંડ ડોલ્યાં  
મેવાડો મસ્તાન  
ભાઈ! ભાઈ! મેવાડો મસ્તાન!  
ઓળોળોળો હાલ્ય હાલુડા હાલ્ય!  
હાલો વાલો રે બાળ કરસન કાળો  
હરિને હીંચકો વા'લો!

[‘રઢિયાળી રત’]

આવા સાદા સ્વરોમાં કોઈ કોઈ ઠેકાણો જ -

લોકગીત સંચય

*Their bows would be bended, their blades would be red,  
Ere the step of a foeman draws near to thy bed.*

એ પંક્તિના વીર-ધ્વનિઓ લળકે છે.

### મહારાષ્ટ્રનાં હાલરડાં

એ વીરત્વના, રાષ્ટ્રભાવના સૂરો હાલરડાંમાં ઉત્તરવાનો યત્ન આજે મહારાષ્ટ્રમાં  
છીક થતો જણાય છે. ત્યાંના કવિઓ સમજ્યા લાગે છે કે શિવાજીએ છીક માતાના ગર્ભમાં  
બેઠાં બેઠાં શૌર્યગીતો સાંભળેલાં. તેઓને સમજ પડી લાગે છે કે છે વીરત્વની સાગી શાળા  
પારણાંમાંથી શરૂ થાય છે. અને બીજુ એ સમજ આવી છે કે જેટલે અંશે નવાં હાલરડાં  
જૂનાંની સરળતાને રંગે રંગાશે તેટલે અંશે એનો રસ ગળી ગળીને માતાઓનાં જીવનમાં  
ઉત્તરશે. એ વિના નવા યત્નો માર્યા જાય છે. મહારાષ્ટ્રમાં ‘પાળજ્ઞા’ એટલે કે પારણાં-  
હાલરડાં નામનું જુનું લોકસાહિત્ય હજુ સારી પેઠે સંજીવન છે. આપણાં

હાલ્ય વાલ્ય ને હેલ્ય  
વગડે વસતી રે હેલ્ય!  
હેલ્યનાં પગલાં રે રાતાં  
ભાઈના કાકા મામા છે માતા.

[‘રદ્ધિયાળી રાત’]

એવાં છૂટક છૂટક ભાવનાં જોડકણાંની માફક મહારાષ્ટ્રમાં પણ -

લક્ષુમીબાઈ આતી, આતીસ જઉ ન કો  
ઘરાલા પદર સોડુ ન કો, કેશવ બાળ!  
લક્ષુમીબાઈ આતી, તાંબ્યાની દૂધ ખાલી  
ઘરાલા માનવલી, વાસુદેવ બાળાચ્યા !  
માળયા ચા મળયા મધે માળી બૈસલા ફૂલો મધે  
કળયાં ઘાલી ટોપી મધે, કેશવ બાળાચ્યા!  
જામાઈ તો જ્યાતા વાડીમાં  
ન માળી બેઠો તો ફૂલામાં  
માળીએ તો ઘાલ્યાં ફૂલ  
બચલા ભાઈની ટોપીમાં]

આવી રસાળી કરીઓ - જાણે કદી નહિ ખૂટે તેટલી - પારણાં હીંચોળતાં હીંચોળતાં  
દક્ષિણી માતાઓ ગાયા જ કરે છે. એનું સૌંદર્ય નિર્વાજ છે, નિરાદમ્બરી છે. હવે એની  
પાસે આધુનિક મહારાષ્ટ્રી કવિ ગોવિંદ રચેલું બાળ શિવાજીનું, રાષ્ટ્રભાવનાથી ટ્પકું  
રોમાંચક હાલરડું મૂકીએ -

‘શિવાજીચા પાળજ્ઞા’

મી લોટીતે ઝોકા તુજ શિવ બાળ  
સુન્દરા નિજ સ્નેહાળ.  
તનુ શાન્તિતે શાન્ત નિજ તુજ યેષ્યા  
રાષ્ટ્રગીત ગાતે તાન્યા!

હું બાલુડા! શિવાજી! હું તારું પારણું જુલાણું છું. જો મારા સુંદર લાડકવાપા! મારા ધ્યાવણી  
બચ્ચા! હું આ રાષ્ટ્રગીત ગાઉં છું તેથી તને નિદ્રા આવશે, ને તારા દેહને શપ્તા વળશે.]

હું દાસી જળે મહી અમિબકા માય  
ભંભરડા ફોરી હાય!  
નજ શત્રુની હિયે ભંગીલે છત્ર  
માંગલ્ય સૂત્ર સ્વાતંત્ર્ય!  
ઘા દુઃખાને દુઃખી ફાર હે પાહી  
મા જ્જાબાઈ તબ આઈ

[આ દાસીનું હૃદય સળગે છે; કેમ કે પૃથ્વી માતા વાણુવિહોણી ગાય જેવી બની ભાંભરડા નાખે  
છે. શત્રુઓએ એનું છત્ર ભાંગી નાખ્યું છે, ને એના કંઠનું મંગલસૂત્ર તોડી નાખ્યું છે. જો ભાઈ! આ  
દુઃખે હું બહુ દુખિયારી બની છું. હું તારી માતા જ્જાબાઈ.]

બહુ શત્રુ માનલે ભેદ  
મેલયોની આર્થિકાન નેદે!  
આમુચે રાષ્ટ્ર તુલિલે  
કાણી નિપજે ના શાસ્ત્રા યા ચાંડાળા - સુંદરો

[પીટ્યા શત્રુઓ બહુ ફાટ્યા, મુઆઓએ આપણી આર્થિક લૂંટી આપણા દેશને પગ નીચે ચગાધો,  
પણ એ ચાંડાલોને સજા કરનારો કોઈ ન નીકળ્યો.]

ભૂમાતેચ્યા ભૂતકાલી ઉદ્જરણી  
ઝુંગલી રણી મૃડરમણી;  
શ્રીરામાને રાવણ વધિલા લઘૂની  
વાનરા વીર વનવોની;  
ઘે સ્વતંત્રતા કંસાચ્યા પાસોની  
ગોવિદ ગોપ જમવોની.

[પૂર્વ ભૂમિમાતાને ઉદ્ધારવા માટે રણમાં પાર્વતીજી જૂઝયાં; શ્રી રામે વાનરોને વીર બનાવી લડાઈમાં  
રાવણને હણ્યો. ગોવિદ પ્રભુએ ગોવાળોને જમાવી કંસ પાસેથી સ્વતંત્રતા લીધી.]

તુ તસા વીર હોશીલ કા?  
તરવાર કરીં ધરશીલ કા?  
મિળવિશીલ માવળે ગડી કા?  
રણી વધાવ યા દેશશત્રુચ્યા મેળા. - સુંદરો

[તું એવો વીર થઈશ કે? હાથમાં તરવાર ધરીશ કે? માવળા લોકોને સાથીઓ બનાવી લઈશ કે?  
રણમાં દેશ-શત્રુઓનાં ટોળાંનો સંહાર કરીશ કે?]'

ભૂભક્તિચ્યં પ્રબલ દુર્ગ પાણ  
મી વીર તુલા બનવીન  
રિપુરક્તે ભૂ તુઝ કરીં ખાણીન  
સ્વતંત્ર ધરી આણીન  
મી સ્વતંત્ર વીરાચી માતા  
મી સ્વતંત્ર સુધન્ય હોતા

લોકગીત સંચય

ધજ સ્વતંત્રતાચ્યા કુલતા

કેવીન તનુ અશ્યા નંદમય વેળા. - સુનદરી

[દેશભક્તતનું બલદાયી દૂધ પિવાડીને હું તને વીર બનાવીશ. રિપુઓના રક્તશી હું લાગે જ થાયે મા-ભૂમિને નવરાવીશ, અને સ્વતંત્રતા ઘેર આણીશ. હું સ્વતંત્ર વીરની માતા બનીશ, તે દિવસે હું સ્વતંત્ર અને ધન્ય બનીશ. સ્વતંત્રતાનો ધજ ફરકવા લાગશે, તેવી આનંદમય વેળાએ હું મારો દેહ છોડશા.]

ગદગદા તદા પાળષ્યાત શિબ હસવા

જણુ માતૃબોલ ત્યા રુચલા!

મગ કરી લીલા મુહુલ મુસ્ટિ વળવૂન

જણુ મહણે ઈને રિપુ વધીન!

અશી આર્ય શિખા રક્ષણ યા ભાવે હો

જાવળાશીતો ખેતે હો!

શ્રી જ્ઞા આઈણા અસા કીડતા તાંડા

દાટલા પ્રીતિચા પાણ્ણા!

[ત્યારે પારણામાં શિવાજી ખડ ખડ હસી પડયો. જાણે માના બોલ એને રુચ્યા. રમતમાં ને રમતમાં એજે સુંવાળા હાથની મૂઠીઓ વાળી, જાણે કહેતો હોયની, કે હું આ મુક્કીથી રિપુઓનો વધ કરીશ.<sup>6</sup>

આવી રીતે હું આર્યોની શિખાની રક્ષા કરીશ - એવો ભાવ દર્શાવતા હોયની, તેમ એ પોતાના બાળ-મોવાળા સાથે રમવા લાગ્યો. ધાવણા બાળુણાને આમ રમતો નિહાળીને જ્ઞાબાઈ માતાને થાનેલે પ્રેમનો પાનો ચડયો]

આ નવયુગી હાલરડાંમાં બલવંત રાષ્ટ્રભાવના સરલ શૈલીએ ઉત્તરી છે. સામાન્ય માતાઓ પણ સમજે એવી નૂતન કલ્યાણ આમાં પૂરેલી છે. મહારાષ્ટ્રની શિષ્ટ જનતા ઉપર એનો પ્રભાવ કદાચ મંત્ર-શો હશે. પરંતુ એ હાલરડું હજુ ગ્રામ્ય માતાઓને કંઠે ટ્પક્યું નથી, કેમકે હજુ પૂરેપૂરું ગળાયું નથી.

ગુજરાતમાં પણ એવી વીરગાથાઓ ઉતારવાનું કર્તવ્ય નવયુગી શાયરોનું છે. વનરાજ, પ્રતાપ, શિવાજી અને અભિમન્યુનો દેશ બાલવીરત્વના ઈતિહાસવિહોણો નથી. એનાં નામા-ક્રમાં જે દિવસે સાઢી છતાં મર્મગામી વાણીમાં પારણાની દોરી તાણનાર માતાને કંઠે ઉત્તરશે, તે દિવસે એ પારણાંમાંથી એકેક યોદ્ધો ઉઠશે. એની માતા જ્યારે એને કહેશે કે -

*The woods and the glens, from the towers  
which we see,*

*They all are belonging, dear babie, to thee.*

ત વેળા પોતાના દેશની મારીનાં ઢેઝાં પ્રયેનું મમત્વ એને અંતરે બરાબર બાળશે અને કંઈક બાળકો એ મારીને પોતાના રુધિરથી ભીજાવવાનાં સ્વખો સેવશે.

\* સરખાવો : 'વનરાજનું હાલરડું'માં -

મૂઠદિયું ભીડાને રે મોભી મારો પોઢિયો હો રાજ !

દાઢદિયું ભાંસીને રે બાળો મારો પોઢિયો હો રાજ !

હા રે જાણે તાણીને અલી તલવાર

હાં રે જાણે સૂરે છે જુદ્ધ મોજાર

સપનામાં સંધારે રે માભૂમિના કાળને હો રાજ.

[કિલ્લોલ]

## મદ્ધત્વસાનું હાલરડુ

હાલરડાંની અસર કેવી થાય છે તેનું દાખાંત તો જુદું આપણી જ નવાળીઓમાં  
પડવું છે. જગતુધજ રાજાની રાણી મદ્ધત્વસા વૈરાગ્યમાં ગળી બદ્ધ હતી. એટલે એણે પોતાના  
બાળકને હીંચોળતી વેળાએ. આ જગતની નાશરતા, આત્માની અમરતા, સુખવૈભવની  
કલાભંગુરતા ઈત્યાદિ ભાવોથી ભરેલાં ગંભીર હાલરડાં ગાયાં કર્યાં કે -

ત્વમસ્તિ તાત શુદ્ધભૂદ્ધ નિરંજન  
ભવમાયાવર્ણિતજાતા  
ભવસ્વભનું ચ મોહનિદ્રાં ત્વજ  
મદ્ધત્વસાહ સુતાં માતા!

(ઓ બેયા! તું તો શુદ્ધભૂદ્ધ નિરંજન છે : જગતની માયાથી રહિત જાતા છે. આ જીવન-સ્વભનું  
તથા મોહનિદ્રાને છોડી દે ! એમ માતા મદ્ધત્વસા પુત્રને કહે છે.)

નામરિમુક્ત શુદ્ધોક્તિ રે સુત  
મયા કલ્પિતાં તર નામ  
ન તે શરીરં ચાસ્ય ત્વમસ્તિ  
કૃ રોદ્વિષ ત્વં સુખધામ!

તે બેયા! તું તો શુદ્ધ છે. નામરહિત છે. તારું નામ તો મેં કલ્પેલું છે. આ શરીર તારું નથી, કે  
નથી તું બેનો. તો હે સુખમય ! તું શીદ રહે છે !)

એવા એવા સચોટ શબ્દોમાં રાણીએ વૈરાગ્ય પ્રબોધતી સંસ્કૃત લાવણીઓ ગાયા  
કરી છે અને છેવટે -

વિમલવિજ્ઞાનવિશ્વેશરવ્યાપક  
સત્યબ્રહ્મ ત્વમસ્તિ જાતા  
પ્રાઇ મદ્ધત્વસાહલક્ર સુતાં પ્રતિ  
શાસ્ત્રપ્રસિદ્ધ વરમાતા!

આ હાલરડાની અગોચર અસરને પરિણામે રાણીના એક પછી એક કુમારો વૈરાગ્ય  
તરફ ઢળી જઈ, યુવાવસ્થામાં પહોંચતાં જ ભગવાં પહેરીને ચાલી નીકળેલા. છેવટે સાતમા  
કુમારની દોરી જેંચીને એ હાલરડું ગાતાંની વાર જ રાજાએ દોટ દઈ, દોરી ઝૂંટવી લીધી  
ને કહ્યું કે 'હવે આ એકને રહેવા દે. નહિ તો મારું સિંહસન સૂનું પડશે. તું કહે તો હું  
ચાલ્યો જાઉં, પણ અને એકને એ હાલરડું સંભળાવવું રહેવા દે !'

એ કથા પરથી પુરવાર થાય છે કે 'હાલરડાં' તો કંઈક યુગોથી ચાત્યાં આવે છે.  
સંસ્કૃતમાં પણ અનું સાહિત્ય રચાતું હતું. અને આજે રવીન્દ્રનાથ જેવા કવિવરે પણ એ  
જુગજુગના વાત્સલ્ય-સ્વરોની અંદર પોતાનાં 'શિશુ' નામક ગીતો ઉમેરીને નવું જ માધુર્ય  
પૂરેલું છે.

## હાલરડાંમાં જોડકણાં

હાલરડાંમાં તો ઊંડા અર્થો ન મૂડીએ તોય ચાલે. બાળકને તાલબદ્ધ સૂરો  
સંભળાવીએ, તો એ તાલનું પણ ભાવપ્રેરક વાતાવરણ પારણાને વીંટળાઈ વળશે. બાળક  
તો જોડકણાંનું ('નર્સરી રૂહાઈભસ'નું) પણ ભૂઘ્યું છે. ટૂંકી પંક્તિઓ -

ભાઈ મારો છે સાગનો સોટે  
આવતી વહુનો ચોટલો મોટો  
હાં...હાલાં!

ઘોડાની પડધી વાગે  
ભાઈ મારો નીંદરમાંથી જાગે;  
ભાઈ ભાઈ હું રે કરું  
ભાઈની વાંસે હું રે ફરું.  
ભાઈને કોઈએ દીઠો!  
કૂલની વાડીમાં જઈ પેઠો.

એમાં તાલ ('રિધમ') છે, અને અસંબદ્ધ છતાં રમ્ય કલ્યનાઓ છે. મારવાડમાં પણ એ  
જ જાતનું હાલરંદું ચાલે છે :

હાલાં હાલાં કરતા'તાં  
સંતોકરા મામા રમતા'તા;  
રમતે ખેલતે બાજરી વાઈ  
બાજરીરા ખેતમેં ઢેલડી વિંયાઈ;  
ઢેલડીરા બચિયા રાતા રે ભાઈ  
સંતોકરા મામા માતા રે ભાઈ  
હાલાં... હાલાં!

બાજરાનું ખેતર : ઢેલડીનું વિયાવું : બચ્ચાનો રાતો રંગ : એમાં કાવ્ય છે, શબ્દોની  
કોમળ રચના છે, તાલની તરલતા છે, પારણે હીંચતા શિશુને માટે એમાં નિદ્રાની લહરીઓ  
છે, માતાનો એમાં વિનોદ છે. અને જુઓ :

સંતોકરા મામા આવતા'તા  
ફાલ પછેડો લાવતા'તા,  
ફાલ પછેડે નવતી ભાત  
સંતોક ઓઢે હિ' ને રાત.  
ઓઢી ઓઢી જૂનો કર્યો  
સરવર પાળે ઝીલવા ર્યાં  
હાડિયો આવ્યો લઈ ગિયો  
કાનમાં વાત કહી ગિયો  
હાલાં! હાલાં!

ફાલ-પછેડો : ભરોવરની પાળ : સંતોક ઝીલણિયાં રમે : કાગડો આવે : કાનમાં કંઈક  
વાત કહી જાય ને પછેડો ચાંચમાં લઈ જાય : એક નાની-શી રમ્ય ને નિગૂઢ દુનિયા ઊભી  
થઈ. એમ બાળકને શીખવવામાં પણ તાલસૂરની સહાય લેવાય :

પા પા પગલી!  
મામાની ડગલી!  
પા પા પગલી!  
મામાની ડગલી!

એને તાલે તાલે નાનું બાળક પોતાના ઘૂઘરીએ ઘમઘમતા પગ માંડ અને તે પણ  
વળી વધુ ત્વરિત ગતિએ ચલાવવા માટે -

ઉગ મગ! ઉગ મગ! ઉગલાં ભરતા  
હરજુ મંદિર આવ્યા,  
પગમાં ડાક જશોદા માએ  
ગોકુળ માંહી ચલાવ્યા  
થેઈ! થેઈ! ચરણ ભરોને કાન  
વંચું મુક્તાફળ ને પાન!

એ તરલ તાલવાળું હાલરડું ગવાય. એ તો ઓરડાની અંદર ચાલતી ચાલ્યા. શેરીમાં  
રમવા સારુ વળી જુદ્દો વધુ તરલ તાલ! ને વધુ કોમલ કલ્યના :

ધુંબડી સૈયરમાં રમે.  
ધુંબડી કાજળાની કોર,  
ધુંબડી આંબાની છાંય,  
ધુંબડી સૈયરમાં રમે!

વળી તાલ બદલાયો :

ગા દોવાને ગોણીઓ  
ઉપર તાંબડી ધુંબડ જાઈને કાજે  
ધુંબડી સૈયરમાં રમે.

ફરી પલટો :

શેરીએ રમે  
સહુને ગમે  
ધુંબડી સૈયરમાં રમે  
બારીએ રમે  
બાપને ગમે - ધુંબડીં  
મેડીએ રમે  
માને ગમે - ધુંબડીં

એ જ શૈલીનું અંગ્રેજી હાલરડું જોઈએ :

*Brown eyes*

*Straight nose;*

*Dirt pies*

*Rumpled clothes.*

*Falling down*

*Off chairs*

*Breaking crown*

*Down stairs*

*Folded hands*

*Saying prayers  
 Understands  
 Not, not cares.  
 Thinks it odd  
 Smiles away :  
 Yet may God*

*Hear her pray!*

આ રીતે નાજુક તાલમાંથી પણ ભાવવાહી રમત નીતરે છે. હાલરડામાં પાંડિત્ય ન હોય, ને છતાં ભવ્ય કટ્યના હોઈ શકે. પ્રકૃતિની ગહનતાને સરસ સ્ત્રી-વાણીમાં કેવી રીતે અવતારી શકાય એ પણ લોકકવિએ કરી બતાવ્યું છે. એ હાલરડામાં મૂકે છે :

તારા મંડળમાં તકતો દીસે

તે મારા ગજવે ઘાલો

ચાંદલિયો ચૂંટિને મારા

હાથડિયામાં આલો. - થેઈ થેઈં.

એવાં રૂપાળાં રમકડાં,

માતાજી, મુજને આલો

આરા તારા વીણીને મારા

ગુજરવડામાં ઘાલો. - થેઈ થેઈં.

એનું જ રૂપાંતર લગભગ એ-ના એ શબ્દોમાં કવિ નહાનાલાલના એક બાલગીતમાં

છે :

નવલખ તારા વીણી, મા, મારા

ગજવામાં ઘાલો

મા, મને ચાંદલિયો વહાલો!

કવિતા પાંડિત્યના પ્રદર્શનને કાજે નથી. કવિતાની નિગૂઢતા એટલે ન સમજાય તેવી શબ્દ-જટિલતા નહિ. કવિતા તો ચંદસૂર્યની કિરણમાલા જેવી હોય, પવનની લહરી જેવી હોય, એ તો માતાનાં ગર્ભધાનથી જ બાળકને રમત અને સંસ્કારો આપે, ભૌયમાં ભીજરોપણ થાય ત્યારે જળ શોષાવીને અંદર ઉતારે, કોંટો ફૂટચો તેને જુલાવે ને જોર આપે. ઝાડ ફ્લે ત્યારે એના પાંડડે પાંડડે ચમકીને જ્ઞાણ દીવા જલાવે. બાળક પરતે કવિતાનું ઝાડ કર્તાનું ભૂખ્યું છે. એને હાલરડાની લહરીઓ પણ એ જ કર્તાનું ભૂખ્યું છે. જનેતાઓના જીવનમાં છેક ગર્ભધાનથી જ કવિતાનું સિંચન આપો, એ સંગીતનું તરસ્યું છે. જનેતાઓના જીવનમાં છેક ગર્ભધાનથી જ કવિતાનું સિંચન આપો, એ સંગીતનું તરસ્યું છે. અને કંઠે કૂણાં મીઠાં, કટ્યના-નીતરતાં હાલરડાં રેડીને એના બોજારૂપ બનેલા જીવનમાં આનંદ પ્રગટાવો : અને આજકાલ તો વિશેષે પુરુષોની લાલસામાંથી નીપજી રહેલાં બાળકો વિશે માવતરને સાચું ભાન કરાવો કે -

તમે મારાં દેવના દીધીલ છો

તમે મારાં માગી લીધીલ છો

આવ્યાં ત્યારે અમર થઈને રો!"

## કુમ

નવેહન		213
વાતસલ્યના સૂરો		215
1. ધો ને રન્નાદે!		239
2. જનેતાના હૈયામાં		240
3. આપણે આંગણીએ		241
4. દેવનાં દીવિલાં		242
5. પોઢો ને!		243
6. બષુ વા'લો		243
7. હાલરડુ વા'લું		244
8. બાળા, પોઢો ને!		245
9. વીર! સૂઈ જા		246
10. નીંદરડી તું આવે જો		246
11. હાલો વા'લો રે		247
12. હં આં...આં હાલાં!		249
13. હાલો! હાલો!		253
14. હાલા રે હાલા		255
15. જન્મોત્સવ		256
16. તારે પારણે		257
17. ધોઘર આવ્યા		258
18. નંદકિશોર		258
19. પારણિયામાં પોઢ્યો		258
20. થેઈ! થેઈ!		259
21. જુગના આધાર		260
22. માતા અનસૂયા જુલાવે		262
23. ભોળી જમના		263
24. કાનકુંવરની જૂલાડી		264
25. કાનાની પછેડી		264
26. ખોળે ખેલાવવાનાં જોડકણાં		265
27. થૈ થૈ પગલી		266

28.	સૈયરમાં રમે .....	267
29.	પારસી-ગુજરાતી હાલરડુ .....	267
30.	બેટા ! સો જાની ! .....	267
31.	નિજ નિજ બાળ રે .....	269
32.	મદાલસાનું હાલરડુ .....	269
	પ્રથમ પંક્તિ-સૂચિ .....	270
		237

## હાલરડાં

ધો ને રનાદે !

[બાળક માતાના પેટમાં હોય ત્યારથી જ એને માટે હાલરડું ગવાય. પહેલી વાર ગર્ભ ધારણા કરતી સ્ત્રીનો ‘ખોળો ભરવા’નો અવસર આવે છે તેને સીમંત કહે છે. એ સીમંતને પ્રસંગે રંદલ અથવા રનાદે (સૂર્યની રાણી)ની સ્થાપના ઘરમાં કરી હોય છે. તેની સન્યુષે એ સ્ત્રીને બેસારીને બીજી સ્ત્રીઓ ટેળે વળી ગાય છે. ગીતમાં વર્ણરેલાં લક્ષણો રાય-રંક સર્વનાં બાળકોમાં સામાન્ય હોય છે.]

લીંઘું ને ગૂંઘું મારું આંગળું,  
પગલીનો પાડનાર ધો ને, રનાદે !

વાંકિયા-મેણાં, માતા, દોયલાં.

દળણાં દળીને ઊભી રહી,  
પાળુંનો પાડનાર ધો ને, રનાદે !

વાંકિયા-મેણાં, માતા, દોયલાં.

પાણી ભરીને ઊભી રહી,  
છેડાનો ઝાલનાર ધો ને, રનાદે !

વાંકિયા-મેણાં, માતા, દોયલાં.

મહીડાં વલોવી ઊભી રહી,  
માખણનો માગનાર ધો ને, રનાદે !

વાંકિયા-મેણાં, માતા, દોયલાં.

<sup>1</sup> ખાયું : ધંટીના થાળામાં, દળતી વખતે ચડતી લોટની શાગ.

રોટલા ઘડિને ઊભી રહી,  
ચાનકીનો માગનાર ધો ને, રન્નાદે !  
વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.

ધોયોધજોયો મારો સાડલો,  
ખોળાનો ખૂંદનાર ધો ને, રન્નાદે !  
વાંઝિયાં-મેણાં, માતા, દોયલાં.

પછી પ્રાર્થનાની ફ્લસિદ્ધિરૂપે ઉપલી દરેક કડી આ પ્રમાણે ફેરફાર કરી ગવાય છે :

લીંઘું ને ગૂંઘું મારું આંગણું  
પગલીનો પાડનાર દીધો, રન્નાદે !  
અનિરુદ્ધ કુંવર મારે લાડકો.

ક્યાંક આમ પજ ગવાય છે :

ઘરને પછવાડે રૂંકું ધોડિયું,  
પારણાનો પોઢનાર દીધો, રન્નાદે,  
વાંઝિયા-મેણાં માએ ભાંગિયાં -

### જનેતાના હૈયામાં

[સાચી વાત તો એમ છે કે કૃષ્ણ દેવકીજીને પેટ કંસના કેદખાનામાં જન્મેલા, ને પછી એના પિતાજી વસુદેવ એમને છાનામાના નંદ-જશોદાને ઘેર મૂકી આવેલા. પજ આ ગીતમાં તો ઈતિહાસ અળગો મુકાયો છે. મુખ્યત્વે તો આ ગીતમાં સગર્ભી માતાનું ચિંતાતુર ચિત્ર ઊભું કરવાનો આશાય છે. મહિને મહિને શાં-શાં ચિહ્નનો જણાય, અને બાળના જન્મસમયે શી-શી વિધિઓ કરાય તેનું વર્ણન છે.]

એક દેવકી જશોદા બે બેનડી, હરનું હલરડું;  
બે બેની પાણીડાંની હદ્દું રે ગોવિંદજનું હલરડું.

દેવકી પૂછે જશોદા કેમ દૂલળાં રે, હરનું હલરડું,  
બાઈ, તારે તે કેટલા માસ રે ગોવિંદજનું હલરડું.

મેં તો સાત જણયાં તોય વાંઝિયાં રે, હરનું હલરડું,  
હરે આઠમાની કરવાની શી આશ રે ગોવિંદજનું હલરડું.

પાંચ માસે તે જાણ્યું અજાણ્યું રે, હરનું હાલરું,  
બીજે માસે તે હૈયડામાં જાણ્યું રે ગોવિંદજીનું હાલરું.

ત્રીજે માસે શૈયરને સંભળવિયાં રે, હરનું હાલરું,  
ચોથે માસે તે ચૂરમાંના ભાવા રે ગોવિંદજીનું હાલરું.

પાંચમે માસે તે પંચમાસી બાંધી રે, હરનું હાલરું,  
છષે માસે તે મૈયર કાગળ મેલ્યા રે ગોવિંદજીનું હાલરું.

સાતમે માસે તે ખોળલા ભરિયા રે, હરનું હાલરું  
આઠમે માસે મૈયરીએ વળાવ્યાં રે ગોવિંદજીનું હાલરું.

નવમે માસે તે કાનકુંવર જલમિયા રે, હરનું હાલરું,  
સોના-છરીએ તે નાળ વધીયા રે ગોવિંદજીનું હાલરું.

એ તો રૂપલાની કોશે ભંડાર્યા રે, હરનું હાલરું,  
પાણી સાટે દૂધડીએ નવરાવ્યાં રે ગોવિંદજીનું હાલરું.

હીર સાટે તે ચીરમાં વીંટાળ્યાં રે, હરનું હાલરું,  
ચોખા સાટે મોતીડે વધાવ્યાં રે ગોવિંદજીનું હાલરું.

બાર વાસાનું બાળક બોલિયું રે, હરનું હાલરું,  
માડી મને રમકડાં લે આલો રે ગોવિંદજીનું હાલરું.

સોનાગેડી ને રૂપલા દૂલ્હિયો રે, હરનું હાલરું,  
જણ જમનાને કાંઠડે દોયાયો રે ગોવિંદજીનું હાલરું.

## આપજો આંગણીએ

[બહેન નાના ભાઈને માટે ગાય છે.]

એક નાનું સરીખડું બાળ રે મા !

આબ્યું છે આપજો આંગણીએ.

એને નમ્યેથી પ્રાઇત જાય રે મા !

આબ્યું છે આપજો આંગણીએ.

એને માથે મેવાડાં મોળિયાં,

એને ખંબે ખાંતીલા ખેસ રે મા. - આબ્યું છે.

એને કાને તે કુંડળ જળકંતાં,

કોટે કૌસ્તુભમણિનો હાર રે મા. - આબ્યું છે.

એની બાંધે બાજુબંધ બેરખા,

એની દસે આંગળીએ વેઢ રે મા. - આવ્યું છે.

એને પગે રાઠોડી મોજડી,

એની ચટકતી છે ચાલ્ય રે મા. - આવ્યું છે.

## દેવનાં દીધેલાં

[માતા ગાય છે કે હે બેટા ! તું તો દેવની દીધેલ દોલત છે. તું તો મારા ઘરનું સુગંધી ફૂલ છે. તું તો મારું સાચું નાણું છે. તારા માટે તો શિવ-પાર્વતીજીને પ્રસન્ન કર્યા અને હનુમાનજીને પણ તેલ ચડાવ્યાં. એવો તું તો મહામૂલો છે. તું ઘણું જીવજે.]

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,

આવ્યાં ત્યારે અમર થઈને રો' !

મા'દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું ફૂલ;

મા'દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,

આવ્યાં ત્યારે અમર થઈને રો' !

મા'દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું હાર,

પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હેયાના હાર. - તમે૦

હડમાન જાઉં ઉતાવળી ને જઈ ચડાવું તેલ,

હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. - તમે૦

પછી ગમે તે નામ મૂકીને માતા થોડો વિનોદ કરી લે છે :

ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફે;

પાનસોપારી ખાઈ ગઈ, કંકોતરીમાંથી રૈ. - તમે૦

ભાવનગર ને વરતેજ વર્ચ્યે રે' બાળુડાની ફે;

બાળુડો જ્યારે જલમિયો ત્યારે જબલા ટેપીમાંથી જૈ

બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. - તમે૦

## પોઢો ને !

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;  
ઘડી જાવને ઘોરિયા માંય, અંબર તમે ઓઢો ને !

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;  
મારા લાડકવાયા લાલ, પીતાંબર ઓઢો ને !

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;  
મારે દો'વી છે કાંઈ ગાય, અંબર તમે ઓઢો ને !

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;  
મારે ઘરમાં છે ઘણું કામ, અંબર તમે ઓઢો ને !

## બહુ વા'લો

પોઢો ને મારા હરિ હાલો હાલો !

તું તો રે તારા બાપને બહુ વા'લો. - પોઢો ને.

તું તો રે તારી માતાનો લાલો. - પોઢોને.

મળવાને આવશે વ્રજ તણા બાળા,

તે તો રે લાવશે ફૂલડાંની માળા,

તું તો રે તારા કાકાને બહુ વા'લો ! - પોઢો ને.

મળવા રે આવશે ગોકુળની ગોપી,

તે તો રે લાવશે ફૂલડાંની ટેપી,

તું તો રે તારી માતાનો લાલો ! - પોઢો ને.

મળવા આવશે મામો ને મામી,

તે તો રે ભમ્મર તાણી રેશે સામી,

તું તો રે તારા મામાને બહુ વા'લો ! - પોઢો ને.

## હાલરડુ વા'લુ

બાળકને હાલરડુ વા'લુ !  
કાનકુવરનું હાલરડુ વા'લુ,  
મીઠા મોહનનું હાલરડુ વા'લુ.

છાનો મારા વીર, ભરી આવું નીર,  
પછી તારી દોરી તાણું. - બાળકનો.

સાવ રે સોનાનું તાંતું પારણિયું ને  
સોનાની સળીએ કાન,  
હેતે નાખું તુંને હીંચકો  
મારો ભૂદરો ભીને વાન. - બાળકનો.

જળ ભરીને આવું નિમેષમાં,  
તાતે જળે નવરાવું,  
રૂડે રૂમાલે લૂઈ કરીને પછી  
ઉંડળ લઈ ધવરાવું. - બાળકનો.

ડાબા તે હાથમાં દોરડી ને  
જમણા હાથમાં માળા,  
ચાપ કર ને તું છોકરા !  
હવે મેલ્ય ધાવ્યાના ચાળા. - બાળકનો.

કાઠા તે ઘઉંની રોટલી ને  
માથે માળવિયો ગોળ,  
ચોળી ખવરાવું તુંને ચૂરમું  
પછી જુલાવું તારા હીંડોળ. - બાળકનો.

અટલસની તારી અંગડી ને  
માથે નીલમની ટેપી,  
મોટે રોપાવું તારો માંડવો  
પરણાવું ગોકુળની ગોપી. - બાળકનો

માથે મેવાડાં મોળિયાં ને  
કુંડળ ઝળકે કાન,  
મરકુલડે જુગ મોહી રિયા  
મારો કાનો ભીનલે વાન. - બાળકનો

છાનો રે ચપ, છાનો રે ચપ,  
પછી તારી દોરી તાજુ, બાળકને હલરકુ વા'લુ.  
કાન કુવરનું હલરકુ વા'લુ!  
મીઠા મોહનનું હલરકુ વા'લુ!

### બાળા, પોઢો ને!

પૂતળી અને મોરલા વડે શોભીતા પારણામાં સુવાડતાં છતાંથે બાળક પોઢતું નથી.  
વહાલઘેલી મારીને તો બેય વાતે દુઃખ! બાળક જાગે તોયે દુઃખ, ને નઘવા માંડે તોયે  
દુઃખ! ઉચાટ થાય, વહેમ આવે, પાડોશાણો પાસે દોડી દોડી પૂછે! કોઈની નજર લાગી  
સુમજુ, એના માથા પરથી રાઈને મીઠું ઉતારે.]

સાવ રે સોનાનું મારું પારણિયું  
ને ઘૂઘરીના ઘમકાર, બાળા પોઢો ને!

ચાર પાયે ચાર પૂતળિયું  
ને મોરવાયે બે મોર, બાળા પોઢો ને!

સુવડાવ્યા સૂવે નહિ  
ને આ શાં કળજગ રૂપ, બાળા પોઢો ને!

જેમ તેમ કરી બાળ સુવારિયાં  
ને કરવાં ઘરનાં કામ, બાળા પોઢો ને!

કામકાજ કરીને ઊભાં રિયાં ને  
તોય ન જાગ્યાં બાળ, બાળા જાગોને!

બાઈ રે પાડોશાણ બેનડી  
ને હજુ તો જાગે બાળ, બાળા જાગો ને!

બાઈ તારું બાળક બીનું છે  
ને લાવો ઉતારીએ લૂણ, બાળા જાગો ને!

સરઝી સાહેલી ભેણી થઈ  
ને જગાડચાં નાનાં બાળ, બાળા પોઢો ને!

## વીર ! સૂઈ જા

સૂઈ જા રે સૂઈ જા !  
કોડીલા કુંવર સૂઈ જા ! લાડકડા વીર સૂઈ જા !

તું રોઈશ તો તારી માત્રાજી મૂખાશે  
વીર ! સૂઈ જા ! - કોડીલાં.

તું રોઈશ તો તારા દાદાજી દુખાશે  
વીર ! સૂઈ જા ! - કોડીલાં.

તું રોઈશ તો તારા કાકાજી કચવાશે  
વીર ! સૂઈ જા ! - કોડીલાં.

તું રોઈશ તો તારી ફેલા ઝાળે જાશે  
વીર ! સૂઈ જા ! - કોડીલાં.

તને રામજી રમાડે,  
તને લક્ષ્મણજી લડાવે  
વીર ! સૂઈ જા ! - કોડીલાં.

તને સીતાજી સુવરાવે,  
તને જશોદાજી ગુલાવે  
વીર ! સૂઈ જા ! - કોડીલાં.

## નીંદરડી તું આવે જો

નીંદરડી તું આવે જો આવે જો !  
મારા બચુ તે ભાઈ સાંનું લાવે જો - નીંદરડીં.  
તું પેંડા પતાસાં લાવે જો - નીંદરડીં.  
તું ખારેક ટેપરું લાવે જો - નીંદરડીં.  
તું બદામ મિસરી લાવે જો - નીંદરડીં.

## હાલો વા'લો રે

હાલો રે વા'લો રે કાન કરસન કાળો

હરિને હીંચકો વા'લો !

શામળી સૂરત શામળો વા'લો હં-હં-હં

માતા જશોદા એમ જ કે, મારો રંગમાં રૂપાળો,

ભાઈ ભાઈ, મોરલી ધજાળો !

હં....હં મોરલી ધજાળો !

ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય

- હાલો રે વા'લો રે ૦

હતું ઈ તો છતું કીધું હં-હં-હં

કાનજી, તારું કામઃ  
વારિ ને વરમાંડ ડોલ્યાં,

મેવાડો મસ્તપાન !

ભાઈ ભાઈ, મેવાડો મસ્તપાન !

હં....હં મેવાડો મસ્તપાન !

ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય !

- હાલો રે વા'લો રે ૦

પરથમ તો ઘોબીડાં લૂટ્યાં હં-હં-હં

જોયું મથુરા ગામ

મામા કંસને મારતાં કાંઈ

વરત્યો જેજેકાર !

ભાઈ ભાઈ, વરત્યો જેજેકાર !

હં....હં વરત્યો જેજેકાર !

ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય !

- હાલો રે વા'લો રે ૦

પાતાળે જઈને કાના હં-હં-હં

નાથ્યો કાળીનાગ,

પોયણ કેરે પાંદડે કાંઈ

પોઢ્યા દીનોનાથ !

ભાઈ ભાઈ, પોઢયા દીનોનાથ !

હં....હં પોઢયા દીનોનાથ !

ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય !

- હાલો રે વા'લો રે૦

દોટ મેલીને દડો લીધો હં-હં-હં

વનમાં પાડી વાટ;

માતા જશોદાએ હાલરંગ ગાયું

ઉગમતે પરભાત !

ભાઈ ભાઈ ઉગમતે પરભાત !

હં....હં ઉગમતે પરભાત !

ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય

- હાલો રે વા'લો રે૦

ચણ્યા કેરો છોડ મગાવું હં-હં-હં

ઓળા પડાવું;

બાળ કાના, છાનો રેને

ગુજાં ભરાવું !

ભાઈ ભાઈ, ગુજાં ભરાવું !

હં....હં ગુજાં ભરાવું

ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય

- હાલો રે વા'લો રે૦

શેરડી કેરો સાંઠો મગાવું હં-હં-હં

પાળીએ છોલાવું;

બાળ કાના, છાનો રેને,

ગુજાં ભરાવું !

ભાઈ ભાઈ, ગુજાં ભરાવું !

હં....હં ગુજાં ભરાવું !

ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય

- હાલો રે વા'લો રે૦

શામળી સૂરત શામળો વાને હં-હં-હં

રંગમાં રૂપાળો;

માતા જશોદા એમ જ કુ'

મારો મોરલી ધજાળો !

ભાઈ ભાઈ, મોરલી ધજાળો !  
હં....હં મોરલી ધજાળો !  
ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય -

હાલો રે વા'લો રે  
કાન કરસન કાળો  
વાળાને હીંચકો વા'લો

હું આં....આં હાલાં !

[નિદ્રાને ધૂટે તેવી અને બાળકના રુદ્ધન-સ્વરો સાથે મળી જાય તેવી એકસૂરીલી  
હલકથી સૌરાષ્ટ્રમાં ગવાતું]

હાલ્ય વાલ્ય ને હંસીનો,  
રાતો ચૂડો ભાઈની માશીનો;  
માશી જ્યાં છે માળવે,  
ભાઈનાં પગલાં રે જાળવે.

હં....હં હાલાં !

હાલ્ય વાલ્ય ને હંસી  
લાડવા લાવશો ભાઈની માશી,  
માશી જ્યાં છે મ'વે  
લાડવા કરશું રે હવે.

હં....હં હાલાં !

હાલ્ય વાલ્ય ને હલકી,  
આંગણે રોપાવો રે રૂડી ગલકી;  
ગલકીનાં કૂલ છે રાતાં,  
ભાઈનાં મોસાળિયાં છે માતાં;  
માતાં થૈને આવ્યાં,  
આંગલાં ટેપી રે લાવ્યાં;  
આંગલાં ટેપીએ નવનવી ભાત  
ભાઈ તો રમશો દા'ડો ને રાત;  
મોસાળમાં મામી છે ધૂતારી  
આંગલાં દેશો રે ઉત્તારી;  
મામાને માથે રે મોળિયાં,  
ભાઈનાં ઉત્તરાવશો હિંગળોકિયાં ઘોડિયાં.

હં....હં હાલાં !

હાલ્ય વાલ્ય ને હેવૈયો,  
ભાઈને ભાવે રે લાડુ સેવૈયો;  
સેવૈયો પડ્યો છે શેરીમાં,  
ભાઈ તો રમશે માંદેવની દેરીમાં;  
દેરીએ દેરીએ દીવા કરું,  
ભાઈને ઘરે તેડાવી વિવા કરું,  
વિવા કરતાં લાગી વાર,  
ભાઈના મામા પરડો બીજી વાર.

હાં....હાં હાલાં !

હાલ્ય વાલ્યના રે હકા,  
લાડવા લાવે રે ભાઈના કાકા;  
હાલ્ય વાલ્ય ને હુવા,  
લાડવા લાવે રે ભાઈના ફુઆ;  
ફુઆના તો ઝોક,  
લાડવા લાવશે ગામનાં લોક;  
લોકની શી પેર,  
લાડવા કરશું આપણો ઘેર;  
ઘરમાં નથી ધી ને ગોળ,  
લાડવા કરશું રે પોર;  
પોરનાં ટાજાં વયાં જાય,  
ત્યાં તો ભાઈ રે મોટે થઈ જાય.

હાં....હાં હાલાં !

હાલ્ય વાલ્ય ને હેલ્ય,  
વગડે વસતી રે ઢેલ્ય;  
ઢેલ્યનાં પગલાં તો રાતાં,  
ભાઈના કાકા મામા છે માતા.

હાં....હાં હાલાં !

હાલ્ય વાલ્ય ને હડકલી,  
ભાઈને ઓઢવા જોતે ધડકલી.

હાં....હાં હાલાં !

ભાઈ મારો છે વજારો,  
સવારો સ્પોનું લઈ શજારો.

સોનું પજું છે શોરીમાં,  
ભાઈ મારો રમશે માંદેવજીની દેરીમાં.

હં....હં હાલાં !

ભાઈને દેશો ને ગાળ,  
ભાઈ તો રિસાઈ જાશે મોસાળ;  
મોસાળે મામી છે જૂઠી,  
ધોકો લઈને રે ઉઠી;  
ધોકો પજ્યો છે વાટમાં,  
ને ભાઈ રમે રે હાટમાં,

હં....હં હાલાં !

ભાઈ મારો છે ડાયો,  
પાટલે બેસીને રે નાયો;  
પાટલો રંગો રે ખસી,  
ભાઈ મારો ઊઠયો રે હસી,

હં....હં હાલાં !

ભાઈ મારો છે સાગનો સોટો,  
આવતી વહુનો ચોટલો મોટો;

હં....હં હાલાં !

ભાઈ મારો છે લાડકો,  
જમશે ધી-સાકરનો રે વાડકો;  
ધી-સાકર તો ગળ્યાં;  
ભાઈના દેરીનાં મોં બળ્યાં;  
ધી-સાકર ખાશે મારુ બચુભાઈ,  
વાટકો ચાટે રે મીનીબાઈ.

હં....હં હાલાં !

ભાઈ મારો છે રે રંક,  
હથે સાવ સોનાનો છે વંક;  
વંકે વંકે રે જાળી,  
ભાઈની સાસુ છે કાળી !  
વંકે વંકે રે ઘૂઘરી,

ભાઈની કક્કી મારો છે સુધરો !

વાંકે વાંકે ઘોતી થોડા,

ભાઈને ધેરે ગાડી ને ઘોડા;

ઘોડાની પડધી વાગે,

ભાઈ મારો નીંદરમાંથી જાગો;

ઘોડાં ખાશો રે ગોળ,

ભાઈને ધેરે હાથીની રે જોડ.

હં...હં હાલાં !

ભાઈ મારો છે ગોરો

એની ડેકમાં સોનાનો રે દોરો;

દોરે દોરે રે જાળી,

ભાઈની કક્કી રે કાળી.

હં...હં હાલાં !

ભાઈ મારો છે અયારો,

ધી ને ખીચડી ચયાડો;

ખીચડીમાં ધી થોડું,

ભાઈને સ્યારુ વાઢી ઝોડું.

ધી વિના ખીચડી લૂણી,

ભાઈના પેટમાં રે દુઃખી !

હં...હં હાલાં !

ભાઈ ભાઈ હું રે કરું,

ભાઈ વાંસે ભૂલી ફરું;

ભાઈને કોઈએ દીઠો,

કૂલની વાડીમાં જઈ પેઠો;

કૂલની વાડી વેડાવો,

ભાઈને ધેરે રે તેડાવો.

હં...હં હાલાં !

હજ્બ તુટુડાં હંકું,

ભાઈને ચોતો રે ચખું;

તુટુડાં જાજો દૂર,

ભાઈ તો શિરાવશે દૂધ ને કૂર;  
 દૂધ ને કૂર તો લાગે ગળયાં,  
 ભાઈના આતમા રે ઠાયા;  
 હડચ તુતુડાં હસજો,  
 વાડીમાં જઈને રે વસજો.

હા....હા હાલાં !

## હાલો ! હાલો !

[શ્રી મહીપત્રામ કૃત 'વનરાજ ચાવડો'માં તેમણે મૂકેલું ઉપલા જેવું જ જૂનું કંદસ્થ  
ગુજરાતી હાલરડું.]

હાલોને તો ગોરી, ભાઈને પારણો હીરની દોરી;  
 ભાઈ તો મારો ગોરો, એની કેડે હીરાનો કંદોરો;  
 હાલો ! હાલો !

ભાઈ મારો એવડો, શેરડીના સાંકા જેવડો;  
 શેરડીને સાંઠે કીડી, ભાઈના મુખમાં પાનની બીડી;  
 હાલો ! હાલો !

મારા ભાઈને કોઈ તેડે, તેને લાડવા બાંધું ચારે છેડે;  
 હાલ વાલ ને હલકિયાં, ભાઈને ઘોડીએ રમે ચરકલિયાં;  
 ચરકલિયાં તો ઊડી ગયાં, ભાઈનાં દુઃખડાં લેતાં ગયાં;  
 હાલો ! હાલો !

ગોરી ને રે ગોરી, ભાઈને મોરી પાલ રે વોરી;  
 પાલનો વાંસ છે પોલો, ભાઈની મામીને લઈ ગયો કરજા ગોલો;  
 હાલો ! હાલો !

હાલો ભાઈને, હાલો ને ગોરી, નવાનગરની જ્વી બારી;  
 છોકરાં પરણો ને મા કુંવારી, જુઓ રે લોકો કળીનાં કૌતક.  
 હાલો ! હાલો !

ઓ પેલા ચાંદને કીડી ધ્યાવે,  
 બહેરો કહે કે બચ બચ બોલે;  
 આંધળો કહે કે લૂંટાઈ જઈએ;  
 નાગો કહે કે લૂંછીઈ જઈએ;

પાડો દૂજે ને ભેસ વલોવે,  
મીનીબાઈ બેઠા માખણ ચોરે;  
હાલો ! હાલો !

સૂત્પા રે સૂત્પા ને સૂત્પા પોપટ, સૂત્પા રૂડા રામ;  
એક ન સૂત્પો મારો વનુભા, જગાડચું આખું ગામ.  
એક ઘડી તું સૂઈ જા રે ભાઈ ! મારે ઘરમાં જાણાં રે કામ.  
કામ ને કાજ સૌ રહેવા દેજો, નાનદિયાને લઈ રહેજો;  
કામેકાજ મૂકો ને પડતાં, રે ભાઈને રાખો ને રડતા.  
હાલો ! હાલો !

નાધરિયા નિદ્રાળુ રે પાતળિયા ભૂખાળુ !  
આખાને રૂરે રે બાવા ! કકડો ખાઈને સૂરે.  
હાલો ! હાલો !

પાલણો પોલા વાંસ, રે બાવા ! ઘોડીએ મોર ને હંસ.  
પાલણિયાં પડિયાલાં, રે ભાઈનાં ઘોડિયાં છે રળિયાલાં.  
હાલો ! હાલો !

નાધરિયાનું પાલણું મેં તો ઘણેક દહેલે દીકું;  
ઓવારીને નાખું રે હું તો રાઈ ને મીકું.  
હાલો ! હાલો !

હાલકડે ને ફૂલકડે કાંઈ મોતીના દડા,  
સધળા રે નિશાળિયામાં વનુભા મારા વડા.  
વડા ને નિશાળિયા જોડે ભાઈ મારાને લેજો,  
ભજ્યાંગજ્યાં નથી ભૂલ્યા, ભાઈની પરીક્ષા કરી લેજો.  
હાલો ! હાલો !

હાલકડે ને ફૂલકડે કાંઈ મોતીના રે બજિયા,  
ભાઈ મારાને ઘોડિયે કાંઈ ચાંદો ને સૂરજ લજિયા.  
હાલો ! હાલો !

નાધરિયાના પાખી રે મારે સૂત્પા ઝૂત્પા સંસાર,  
જાગ્યા જયારે વનુભા ત્યારે રાંધ્યા હતા કંસાર.  
હાલો ! હાલો !

ભાઈ રે મારો ભાઈ ! મહારાજાનો જમાઈ,  
રાજાની કુવરી કાળી, ભાઈએ જાન પાછી વાળી;  
રાજાની કુવરી ગોરી, ભાઈએ વહેલો પાછી જોડી;  
મોટ જોડચા ધોરી, રે ભાઈએ પાસે બેસ્પાડચાં ગોરી.  
હાલો ! હાલો !

હાલો રે હાલો ! ભાઈને હાલો ઘણ્ણો વા'લો;  
ભાઈને ગોરીડાં રે ગાજો, ભાઈને રમવા તેડી જાજો;  
ગોરી ગાયનાં દૂધ, ભાઈ પીશો ઉગતે સૂર;  
ભાઈ માડીને છે વા'લો, ભાઈ મામાને છે વા'લો;  
મામા પોહોડે સેજડી, વાયુ ઢોળે બે'ન ભાજોજડી.  
હાલો ! હાલો !

હાથે ને પગે કલ્લાં સાંકળા, રે માથે મજિયા વેપી;  
અટલસનાં અંગરખા, રે એને બજિયે બજિયે મોતી;  
ભાઈ મારાનાં મુખડાં હું ફરીફરીને જોતી.  
હાલો ! હાલો !

ભાઈ મારો ભમતો, શેરીએ શેરીએ રમતો;  
શેરીએ શેરીએ દીવા કરું, ભાઈ રમે ને હું જોતી ફરું.  
હાલો ! હાલો !

## હાલા રે હાલા

[સ્વ.૦ રષ્ણજિતરામ સંગૃહીત]

હાલા રે હાલા, ભાઈને હાલા,  
ભાઈ તો અયદાર, મોજડી પહેરે પયદાર,  
મોજડીઓ ઉપર મોગરા, ભાઈને રમાડે રાજાના છોકગ.  
હાલા રે હાલા.

ભાઈ તો રાજા ભોજ; ભાઈને બારણે હાથીઘોડાની ઝેજ;  
ઘોડીલાની પડધી વાગે, ભાઈ મારો જબકીને જાગે.  
હાલા રે હાલા.

હાલા રે હાલા, ભાઈને રજાછોડરાય વા'લા;  
રજાછોડરાય કાળા, ભાઈને કોટે મોતીની માળા.

હાલા રે હાલા.

ભાઈને તો કોઈ તેરે, લાડવા બાંધું છેરે;  
ભાઈ તો રમશે, રાણી રન્નાદેને ગમશે;  
તાપી માતા તારણે, ચાંદો-સૂરજ ઉગે ભાઈને પારણે;  
પારજાના પોપટ વામજા, ભાઈના બોલ લાગે સોહામજા;  
હાલા રે હાલા.

ભાઈ તો મારો રિસાળ, રિસાઈ જાશે રે મોસાળ;  
મોસાળની મામી દુતારી, અંગલાં ટેપી લેશે ઉતારી.

હાલા રે હાલા.

હાલ કરો રે હુલ કરો, ભાઈની ટેપી ફરતાં ફૂલ ભરો;  
ફૂલે ફૂલે જાળી, ભાઈની મામી કાળી;

હાલા રે હાલા.

હાલ વાલ ને હાંસી, દુખડાં ખુરે ભાઈની માશી;  
માસી ગઈ કાશી, માસો થયો સંન્યાસી;

હાલા રે હાલા.

હાલો હાલો મારા ભાઈને હાલો, ભાઈને હીંચકો ઘણો રે વા'લો;  
ભાઈને ગોરી ગા જો ગમતી, ભાઈને નીંદર આવે રે રમતી;  
ભાઈને ગોરી ગાઉં ને દળું, ભાઈને કાજે ઝીણી સેવો રે વજું;  
ભાઈ તો મારો આવડો તેવડો, કાલે થશે શેલડીના સાંઠ જેવડો;  
શેલડીએ ચડી કીડીઓ, ભાઈ ચાવે પાનની બીડીઓ;

હાલા રે હાલા.

હીરની દોરીઓ અંકાવું, ભાઈને ઘોડિયે રે ટંકાવું;  
હીરની દોરીને હીરા, લાડવા લાવે ભાઈના રે વીરા;  
હે ને ઝૂતરા કાન કાપું, ભાઈને રડતો છાનો રે રાખું.

હાલા રે હાલા.

## જન્મોત્સ્વ

અં અં કરે ને બાળો અંગળાં ધાવે,  
નગરીનાં લોક સરવે જોવાને આવે.

ખમા મારા કાનકુવરને કારડો ભાંયો,  
કાંદે ભાંયો ને વા'તા કેસડી વાળ્યા.

અડવો કે'શું ને બડવો કહીને બોલાવશું,  
ફૈપરનાં નામ વન્યા વશબોલ્યાં રે'શું,

એક આવી ને ઘમ ઘમ ઘૂઘરા લાવી.  
બીજી આવી ને કડાં સાંકળાં લાવી;

ત્રીજી આવીને વેઢ વાંકડા લાવી,  
ચોથી આવીને લંપાઈ ઘોડિયા આગળ બેસશું.

### તારે પારણે

તારે પારણે પોપટ બોલે છે,  
તારે ઘોડીએ મોરલા ડોલે છે;  
સૂઈ રો' ને કાન !  
હાલરડાં હુલરાવે જશોદા માવડી !

તારે હાલરડે હીરની દોરી  
તુને હુલરાવે જશોદા ગોરી;  
સૂઈ રો' ને કાન. - હાલરડાં

કાના, કામ કરું કે તુજને તેદું !  
મારે જાવું છે જળ જમના બેદું;  
સૂઈ જાવ ને કાન. - હાલરડાં

કાના, બારણે તે બોલે બાઘડિયા,  
તારે પારણે ઘૂમે રસ મોરલિયા;  
સૂઈ જાવ ને કાન. - હાલરડાં

કાને વાછરું વાળ્યાં ને ગાવ દોવડલી,  
ગોપી મહી રે થોડાં ને છાશ આવડલી,  
સૂઈ જાવ ને કાન. - હાલરડાં

મારે જાવું છે નરસૈ મે'તાને બારણીએ,  
પ્રભુ આવી ઉભા મારે પારણીએ;  
સૂઈ જાવ ને કાન. - હાલરડાં

## ઘોઘર આવ્યા

[સ્વ.૦ મહીપતરામ સંગૃહીત]

સૂવો સૂવો બાવા રે ઘોઘર આવ્યા.  
ઢંકણીએ ઢંકતા આવ્યા, સૂપડીએ સંતપ્તા આવ્યા.  
વાળ જેવડો રોટલો લાવ્યા, પૈડા જેવડો પાપડ લાવ્યા.  
વાંસ જેવડા ચોખા લાવ્યા, ચાળણી જેવડી દાળ લાવ્યા.  
પૃથ્વીની પત્રાવળ કિધી, સાગરનો તો પડિયો કિધો.  
ઘોઘર સઘળા જમવા આવ્યા, કૂવાને પાજીએ નહતા આવ્યા.  
સૌ મળીને જમવા બેઠા, જમતાં જમતાં વહી પડ્યા.

## નંદકિશોર

નંદકિશોર રે નંદકિશોર,

જૂલે પારણિયે નંદકિશોર  
સોનાના મોર જૂલે નંદકિશોર  
ઘારાને પારણો સોનાના મોર.

કોઈ રે કાનાને નેણો સારો કાજળિયાં,  
ફરતી મેલાવો રૂડી કસુંબલ કોર. - ઘારાનો.

હીરા માણેક તો જડિયાં પારણિયે,  
બાજુ શોભે રૂડી મોતીડાંની કોર. - ઘારાનો.

સોનાનાં સોગઠાં રૂપાનાં રમકડાં,  
કાનો કરે છે માંહીં મીઠા કલ્લોલ. - ઘારાનો.

હેતે કરીને ગોપી હરિને જુલારે,  
અથે શોભે છે રૂડી હીરલાની દોર. - ઘારાનો.

બલાનંદ કહે ખમા રત્સિયા વાલમને,  
અવિચળ રહો રાધીકૃષ્ણની જોડ. - ઘારાનો.

## પારણિયામાં પોઢ્યો

ઓળોળોળો હાલ્ય વાલ્ય રે  
પ્રીતમ પારણિયામાં પોઢ્યો

ધજ્ઞા સોનાનું પારણું ને કોરે વીજળી રહકે,  
પારણિયાને ફર ફરતી રતન ચૂંનીઓ જગકે.

- ઓળોળોળો.

સોનાની સાંકળીઓ સુંદર રેશમની છે દોરી,  
ચાર ખૂઝે ચંદરવા ટંક્યા, વર્ચે સૂરજની જોડી.

- ઓળોળોળો.

મોર ચકલીઓ પૂતળીઓ ને જ્યૂમખડાં સોનાના,  
રમણ્ણમ રમણ્ણમ બજી રથાં મારા લાલ રહો ને છાના.  
- ઓળોળોળો.

હીર ચીરનાં બાળોતિયાં ને હથમાં ધાવજી જાલી,  
લાડકવાયો બાળક જૂલે, મે'ર કરી મતવાલી.

- ઓળોળોળો.

ભીડ થઈ જશ્પોદાને મંદિર જોવા છેલછલીલા,  
પગતચિયે પિલાઈ ગયા પ્રેમીજન ભગતીવાળા.  
- ઓળોળોળો.

## થેઈ ! થેઈ !

[બાળકને ચાલતાં શીખવતી દેળા માતા આ ગીત ગાય છે અને બાળકનો હથ  
જાલી ડગલાં ભરાવે છે. ગીતનો તાલ બાળકની પહેલવહેલી થેઈ ! થેઈ ! પગલીઓ જેવો  
જ છે.]

ડગમગ ! ડગમગ ! ડગલાં ભરતા હરજી મંદિર આવ્યા,  
પગમાં ડક જશ્પોદા માએ ગોકુળમાં ચલાવ્યા.

થેઈ થેઈ ચરણ ભરો ને કાન,  
રેંયું મુક્તાફણ ને પાન !

સારી સારી સુખડિયું તારા ગુંજડિયામાં ઘાલું;  
મોતીસરના લાડવા તારા હથડિયામાં આલું રે. - થેઈ થેઈ.

પૌંવા મગાવું દૂધે પલાણું, હરિને ઝીણી આલું;  
શેરડીનો સાંઠો મગાવું, છોલાવું, મગ ઝોલું. - થેઈ થેઈ.

તાલ યંચકા શંખ ફેરકણાં ઉભાં ઉભાં મગાવું;  
રેશમ દોરી પટવા કેરી ફ્રમક ચોક નખાવું. - થેઈ થેઈ.

બાળક એ કશું લેવા ના પાડે છે. એ તો માગે છે આકાશથી ચીજો! :

તારામંડળમાં તકતો દીસે તે મારે ગજવે ઘાલો;  
ચાંદલિયો ચૂંટીને મારા હાથડિયામાં આલો રે. - થેઈ થેઈ.

એવાં રૂપાળાં રમકડાં માતાજી મુજને આલો !  
આરા તારા વીષ્પીને મારા ગુંજવડામાં ઘાલો. - થેઈ થેઈ.

અમે પ્રભુજી અલપ જીવડો તમથી લેવાય તો લ્યો રે. - થેઈ થેઈ.  
સોના ચકરડી લાલ ભમરડી આકાશેથી ઉતારી;  
પ્રભુ તમારી લાલ કસુંબલ મુખડાની બલિધરી !

થેઈ થેઈ ચરણ ધરો ને કાન  
વેંચું મુક્તપદ્ધણ ને પાન !

### જુગના આધાર

દેવકીજીને શ્રીકૃષ્ણ જલમિયા !  
કે જલમ્યા જુગના આધાર

જલમ્યા જુગના આધાર  
ત્રિભોવન તારા રે ઊંઘડ્યા !

ઊંઘડ્યા રાજ્ઞદરબાર  
ઊંઘડ્યા રાજ્ઞદરબાર

નંદજીને ગઈ રે વધામણી.  
શી શી રે આલું વધામણી !

કે આલ્યાં રતન બેચાર  
આલ્યાં રતન બેચાર

જશોદાએ જોશી તેડાવિયા !  
કે જોશી જો રૂડા જોશ  
જોશી જો રૂડા જોશ

કેવા નખતરમાં જલમિયા !  
રૂડા નખતરમાં જલમિયા !  
કે તેનું શ્રીકૃષ્ણ નામ  
જુગમાં થાશો જો જાણ

સોચશે પૂતનાના ગ્રાજ  
મામા કસને રે મારશે !

સોનારુપાનું રે પારણું !  
કે પોઢશે નંદકિશોર

પોઢશે નંદકિશોર

જાદવકુળની રે ગોદડી ;

હીરના બાંધ્યા છે દોર  
હીરના બાંધ્યા છે દોર  
હરજે હાલરદું ગાય છે !

રો મા ! રો મા ! રે બાળકા !

બારણે બેઠું છે હાઉ !  
બારણે બેઠું છે હાઉ !  
મા મને હાઉલું દેખાડચ  
મા મને હાઉલું દેખાડચ  
હાઉ છે લંકા લખેશરી !

માડી મને નવ જાણીશ નાનકો !

કે કાલે મોટેરો થૈશ  
કાલે મોટેરો થૈશ

વરી મારીશ હું આપણા.

સોનારુપાની રે ગોળિયું;  
કે ગોળિએ વળગ્યા મા'રાજ  
ગોળિએ વળગ્યા મા'રાજ  
ગોળિ ફોડી કટકા કર્યા.

કે કટકા કરિયા દસવીસ  
જશોદાને ચાદિયેલી રીસ  
દીકા માર્યા દસવીસ  
કાનો ચાલ્યો છે રિસામજો !

વાટે જાતા કોઈ વાળો  
વાટે જાતા કોઈ વાળો  
રાંધું ઝીર ખાંડું રોટલી.

ગોખીએ રેડાવું થી  
ગોખીએ રેડાવું થી  
કુર રધાવું કમોદન્ની.

લર્વિંગ સોપારી ને એલચી  
બીડલાં વળો મા'રાજ  
મુજમાં મેલો મા'રાજ  
દળણું ઢણકતા છોલિયા  
કે પોઢો મારાં બાળક !  
પોઢો મારાં બાળક !  
દેવકીજીને શ્રીકૃષ્ણ જલમિયા !

### માતા અનસૂયા ઝુલાવે

[બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, ત્રણોય દેવ હતા. તેમણે સાંભળેલું કે ધરતી પર અત્રિનામનના ઋષિને એક અનસૂયા નામે અતિશય રૂપાળી સતી સ્ત્રી છે. તેઓ લિક્ષા લેવાને બહાને ઋષિના આશ્રમમાં આવ્યા. સતી એકલાં જ હતાં. દેવો કહે કે ‘સતી ! તમે અમને નજીન સ્વરૂપે લિક્ષા આપો !’ સતી તો બોલે બંધાયાં હતાં. વળી પોતાનું શિયળ પણ સાચવવું હતું. એના શિયળને પ્રતાપે એજો ત્રણોય દેવોને છોકરાં બનાવી લીધાં, ઘોડિયામાં નજીન રૂપે સુવાડીને હીંચ્યોયાં અને પાપી મનવાળા દેવોને છોડાવવા તેમની ત્રણોય સ્ત્રીઓ આવી કરગરી ત્યારે સૌની મીઠી ઠેકડી કરીને છોડ્યા.]

માતા અનસૂયા ઝુલાવે પૂતર પારણો રે !

ત્રણો દેવો આવ્યા અત્રિ ઋષિને આશ્રમે રે  
માતા અનસૂયાનું સત છોડવા કાજ  
માતા અનસૂયા ઝુલાવે પૂતર પારણો રે !

અતિથિ રૂપે આવ્યા લિક્ષા લેવા કારણે રે  
સતી દિગભર રૂપે લિક્ષા આપો આજ. - માતા૦

સતીએ અંજલિ ભરીને દેવોને માર્જન કર્યા રે;  
બનિયા બાળક રૂપે ત્રણો અતિથિ દેવ. - માતા૦

માએ પૂતરભાવે પયનાં પાન કરાવિયાં રે;  
તેના પુન્ય તણો ત્યાં રણો નથી કાંઈ પાર. - માતા૦

વાણ્યા આલાલીલા ચોગઈ ચારે વાંસડા રે;  
તેનો ઘડિયો છે કાઈ પારણિયાનો ધાર. - માત્રામ.

પારણું વળગાડચું છે આંબા કેરી ડાળીએ રે;  
તેમાં પોઢકચાં છે ત્રણે અતિથિ-બાળ - માત્રામ.  
સતીએ હીરલા દોરી લીધી છે કંઈ હથમાં રે;  
માતા હલવલ ! હલવલ ! કરી ખલરડાં ગાય. - માત્રામ.

મારા કાળા ગોરા ઘઉંલા કુવર કાનજી રે;  
તમારા નામ ઉપરથી જાઉં હું તો બલિહાર. - માત્રામ.

બલ્લા, વિષ્ણુ, શંકર, બાળા, પોઢો પારણો રે;  
સૂઈ જાઓ ઉમિયા લખમી સાવિત્રીના કંથ. - માત્રામ.

પ્રભુએ મે'ર કરી મનગમતાં બાળક આપિયાં રે  
ભાંગ્યાં વાંગી-મેણાં, અતિ ઘણ્ણો આનંદ. - માત્રામ.

કાકા, મામા, માશી બોલો મારાં બાળકાં રે!  
જે કોઈ બોલે એને આપું કૂલનો હર ! - માત્રામ.

ત્રણે સતીયું ચાલી માતા પાસે જાચવા રે;  
માતા અનસૂયાજી આપો અમારા કંથ. - માત્રામ.

માતા અનસૂયાજી મુખથી એવું બોલિયાં રે;  
સતીયું ઓળખી ત્યો તમ સૌ સૌના ભરથાર. - માત્રામ.

## ભોળી જમના

સોનલા ઈંગ્રેજી રે ભોળી જમના  
રૂપલાનું લેદું રે ભોળી જમના  
વીશ બેડાં ભરિયાં રે ભોળી જમના  
એક લેદું ખાલી રે ભોળી જમના  
ત્યાં તો બાળ ઉઠાં રે ભોળી જમના  
કેમ દોરી તાણી રે ભોળી જમના  
આમ દોરી તાણી રે ભોળી જમના  
પછી ખેતર જ્યાંતાં રે ભોળી જમના  
ત્યાં તો હરણ આવ્યાં રે ભોળી જમના  
કેમ હરણ ઠેકે રે ભોળી જમના  
આમ હરણ ઠેકે રે ભોળી જમના

## કાન્કુવરની જૂલડી

કુષ્ણજીની આંગડી ખોવાઈ. ત્યાં તો માતા જશોદાજી આકળાં-બેલાકળાં થઈ ગયાં.  
એના મનમાં તો એમ કે મારા દીકરા વગર બીજા કોઈને એ વસ્ત્ર ઓપે જ નહિ! મનમાં  
થયું કે પેલો ટીખળી નારદજી જ મારા બેટાની જૂલડી ચોરાવી ગયો હશે! એને બોલાવી,  
આકરા સમ ખવરાવી, એનું સાચ નક્કી કરવા હું ધગધગતો ગોળો ઉપડાવીશ !

ધન્ય ગોકળિયું ધન્ય વનરાવન ધન્ય ગોકળની નારી !

માતા જશોદા ધોવા જ્યાંતાં જૂલડી વિસારી

કોઈને જડી હોય તો દેજો મારા કાન્કુવરની જૂલડી !

સાચ સોનાની જૂલડી મંદી રૂપાના છે ધ્યાગ,

અવર લોકને અરદે નહિ મારા કાન્કુવરના વાધા. - કોઈને.

શેરીએ શેરીએ સાદ પડાવું, ઘર ઘર હીંદું જોતી,

જૂલડીને છેડે મારાં અમૃત સાચાં મોતી. - કોઈને.

ધમજી ધમાવું ગોળા તપાવું નારદને તેડાવું,

જૂલડીને કારજા એને તપતા સમ ખવરાવું. - કોઈને.

## કાનાની પછેડી

નવાનગરમાં નવલી વાત, કાન ઘડાવે નવસર હાર;

હાર ઘડાવતાં લાગી વાર, કાન પછેડી રહી કમાડ !

આવી લુવારજ દીવડો લઈ, વળતાં પછેડી લેતી ગઈ.

તેડાવો લુવારજ ચલવો જાજ,

તેં કેમ લૂંટ્યાં ગોકળ ગામ !

નથી લૂંટ્યાં અમે ગોકળ ગામ,

નથી દુવ્યા અમે શ્રી ભગવાન;

કેસી પછેડી કેસી ભાત, કેસો કાનુડો કેસી રાત !

ધોળી પછેડી હુંઠજા ભાત, કાળો કાનુડો આઠમ રાત;

ઓશીકે મેલીને કાન પાંગતે જુએ,

પછેડી સંભારી કાન ધુશકે રૂવે ! - નવાનગરમાં.

આવી સુતપરાજ બાજોઠ લઈ, વળતાં પછેડી લેતી ગઈ;

તેડાવો સુતપરાજ ચલાવો જાણ,

તેં કેમ લૂટ્યાં ગોકુળ ગામ !

નથી લૂટ્યાં અમે ગોકુળ ગામ,

નથી દુલ્યા અમે શ્રી ભગવાન;

કેસી પછેડી કેસી ભાત, કેસો કાનુંડો કેસી રાત !

પીળી પછેડી પોપટ ભાત, કાળો કાનુંડો આઠમ રાત;

ઓશિકે મેલીને કાન પાંગત જુએ,

પછેડી સંભારી કાન ધૂશકે રૂબે ! - નવાનગરમાં૦

આવી કુંભારજા માટલાં લઈ, વળતાં પછેડી લેતી ગઈ;

બોલાવો કુંભારજા ચલાવો જાણ,

તેં કેમ લૂટ્યાં ગોકુળ ગામ !

નથી લૂટ્યાં અમે ગોકુળ ગામ,

નથી દુલ્યા અમે શ્રી ભગવાન;

કેસી પછેડી કેસી ભાત, કેસો કાનુંડો કેસી રાત !

રાતી પછેડી રીંગણ ભાત, કાળો કાનુંડો આઠમ રાત;

ઓશિકે મેલીને કાન પાંગતે જુએ

પછેડી સંભારીને કાન ધૂશકે રૂબે ! - નવાનગરમાં૦

## ખોળે ખેલાવવાનાં જોડકણાં

[જુલાવવાનું]

જૂલ હૃથીડા જૂલ

તારી જૂલમાં કમળજૂલ.

[કુદાવવાનું]

કૂદ ઘોડા કૂદ

તારી નળીઓમાં દૂધ

ઘોડો બાંધ્યો બજાર

ઘોડો ખાય ચણાની દળ

તું તો નાનો છો ત્યાં કૂદ

મોટો થૈશ, ઢીકા જૈશ

તું તો શેરીએ ભાગ્યો જૈશ.

[નચાવવાનું]

આજ મારો નાનકો નાચ્યો નથી,  
કૂદ્યો નથી  
કડચની ઘૂઘરી વાગ્દી નથી.  
બટકુંક રોટલો, ટીપું ધી  
નાચ રે નાનકા રાત ને દી.

[પ્રથમ પગલી]

પા પા પગલી  
મામાની ડગલી

શૈ શૈ પગલી

[સૂરત બાજુનું : નમહિ સંગ્રહેલું]

થાંગનાં માંગનાં થૈ રે થૈ, નાધિયા નરહરિ તું ને થૈ રે થૈ.

પાતળિયા પુરખોતમ તુને થૈ રે થૈ,  
બાળુડા બળિભદ તુને થૈ રે થૈ. – થાંગનાં.

જો જમણા બે રોહો રે સાઈ.  
તો હું ચાલવાને શીખું મારી આઈ. – થાંગનાં.

જો અંગળડી આપો મુજ હાથ,  
તો હું ચાલવા શીખું મોરી માત. – થાંગનાં.

ડગમગતો ડગલાં કેમ ભરું,  
ને અલંગ તલંગ ચાલતો બીહું. – થાંગનાં.

ઘૂંટણીએ ઘૂંટણીએ હરિ હત્યા જાય,  
કચરો ખૂંદે ને માટી ખાય. – થાંગનાં.

જઈ રે પોઢ્યા પ્રાગાવડને પાન,  
તઈએ તમે ના બ્હીના રે ભગવાન. – થાંગનાં.  
જ્યારે પોઢ્યા રે હરિ મારી પાસ,  
ત્યારે છૂટી રે હું તો ભવના પાસ. – થાંગનાં.

## સૈયરમાં રમે

[નાની બહેનને શેરીમાં કુદાવવાનું ગીત. ‘ધૂલડી’ નાની બહેનનું નામ.]

ધૂલડી સૈયરમાં રમે  
ધૂલડી કાજળની કોર  
ધૂલડી આંબાની છાંય.

– ધૂલડી૦

ગા દોવાને ગોણિયો  
ઉપર તાંબડી ધૂલડ જાઈને કાજે.

– ધૂલડી૦

ધોરજુનો ઢોલિયો  
પાટી હીરની ધૂલડ જાઈને કાજે.

– ધૂલડી૦

શેરી રમે સહુને ગમે  
ધૂલડી સૈયરમાં રમે.

ફળીએ રમે ફઈને ગમે  
ધૂલડી સૈયરમાં રમે.

બારીએ રમે બાપને ગમે  
ધૂલડી સૈયરમાં રમે.

મેડીએ રમે માને ગમે  
ધૂલડી સૈયરમાં રમે.

બા'ર રમે બે'નને ગમે  
ધૂલડી સૈયરમાં રમે.

## પારસી-ગુજરાતી હાલરડું

[એક ઘણા લાંબા હાલા-ગીતમાંથી નમૂનાની કઠીઓ]

જી, જી, હો-ઓ હો-ઓ.  
હો કરું હો ગાવું  
રે ગાઈવાઈને નાંઢલિયાને પારણે પોહરારુ.

હો કરું હો બાઈ,  
રે મરું ! બાઈ મારીના જીવે રૂરા બાઈ.

બાઈને મરું ભલાઈ,  
રે મરું ! નાંદલિયા વહાલા ! તમોને જી માંગું નરાઈ.

મારા દાદારજીને કેહેવું,  
રે હું તો તેની પાસે ઉવા ને દુવા માગી લેવું

દાદારજીના દુવા,  
રે તમુને વધી, મરું ! લાંબા આઈશ ને મોટા ઉવા.

ઉવાની વધી તમારી ઘોરી,  
રે મરું ! ફારે ને સોલે નાંદલિયા ઘોરી.

મારા મેહર ઈજદની મેરબાની,  
રે તમુંને શરોરી ઈજદ કરે પાસબાની.

ઝોરીએ પોપટનાં જોરાં,  
રે મરું ! ઘેરમાં ફરે નાંદલિયાનાં ટોલાં.

મામા ને કૂઈના એક,  
રે મરું ! રમજો કેવરા ને મોઘરાની હેઠ.

કેવરો રે મોઘરો ચુંયવું.  
રે મરું ! નાંદલિયાની ગોલાબે વારી ગૂંઠાવું.

તું તો મારો જીવે,  
રે મરું ! ધી સાથે સાકર ફૂલ ભરું રે મારે દીવે.

દીવેનાં ધી તો ઘારાં,  
રે મરું ! માએ માસી મમઈ બપર્છ કૂઈના પેટ કરમ યહરાં.

નાંદલિયો=નાનડિયો, પોહરારું=પોઢાડું, રૂરા=રૂડા, નરાઈ=નરવાઈ, નીરોગીપણું. કહેવું=કહું,  
લેવું=લઉં, આઈશ=આયુષ્ય, 'ઝોરી'=ઝોળી, જોરાં=જોડાં, ટોલાં=ટોળાં. 'મેહર ઈજદ' અને  
'શરોરી ઈજદ' પારસી દેવદૂતો લાગે છે. ઘારાં=ઘાટાં, ઘજાં. મમઈ=માની મા.  
બપર્છ=બાપની મા. ટારાં=ટાઢાં.

## બેટા ! સો જાની !

[હિંદુસ્તાની]

બાબા તરે બારે હજારી આયા સૂખેદાર  
મૈયા તરી સદા સોહાગન, બર્ચે પર કુરબાન  
બેટા સો જાની !

<sup>1</sup>તરી રે બકૈયાં લું સો જાની.

આગરેકા ઘઘરા બુરાનપુરી કોર  
ભાવનગરકી ગોરી લોડી, ખડી હિલાવિન દોર  
બેટા સો જાની. - તરી રો.

<sup>2</sup>પીપલ બાંધું પારણા ને નીચે બિછાંતું ચીર,  
<sup>2</sup>આતે જાતે ઝેલ ડાલું, સો જા મેરા વીર  
બાલક સો જાની. - તરી રો.

## નિજ નિજ બાળ રે

[મરાಠી]

નિજ નિજ બાળ રે  
ઝોકે દેત મી તુજલા.

સુતાર ઉત્તમસા  
તુજ સાઈ બનવિલા  
પાળજા રંગાંત મનવિલા  
ચહુ બાજુની ચિમળ્યા મોર બસ્યવિલે  
પાળજ્યાત કૃષ્ણ નિજવિલે  
- નિજ નિજ બાળ રે.

ઝોકા દેતા હત દુઃખલા  
ગાણા ગાતા કંઠ સુકલા  
બગા બાયા ! તુ હરિ પાલજ તૂટલા  
ના જનૂ ખડા બરા રૂટલા  
તુઝા સાટી પાલજ ગુટલા  
- નિજ નિજ બાળ રે.

હે બાળ, સૂઈ જા, સૂઈ જા, હીંચોળા દઈ દઈને હાથ દુઃખ્યા, સુતાર તારે આરુ  
રંગિત પારણું બનાવીને લાવ્યો, ચારે બાજુ ચકલી ને મોર બેસાર્યા, પારણો કૃપણને સુવાડ્યા,  
ઠેલા દઈ દઈને હાથ દુઃખ્યો, ગાણું ગાઈ ગાઈને ગળું સુકાયું, જો, જો, પારણું તૂટ્યું.

## મદાલસાનું હાલરડું

[સંસ્કૃત]

ત્વમસિ તાત શુદ્ધબુદ્ધનિરંજન-ભવમાયાવજિતજ્ઞાતા ।

ભવસ્વર્જં ચ મોજનિદ્રાં ત્યજ મદાલસાઽલર્કસુતં માતા ॥ ૧ ॥

નામમુક્તશુદ્ધોऽસિ રે સુત મયા કલ્પિતં તવ નામ ।

ન તે શરીરં ન ચાસ્ય ત્વમસિ કિં રોદિષિ ત્વं સુખધામ ॥ ૨ ॥

શબ્દો વાડયં ત્વં ન રોદિષિ ત્વં તુ ચરાચરભવસ્વામી ।

મુક્તિવ્યવજરસિદ્ધયે વિવિધકલ્પિતો દશગામી ॥ ૩ ॥

ભોગવશાચ્ચ વિપુચતા દેહે ભવતિ સુકૃશતા તદભાવે ।

નૈવ વિપુચતા નાસ્તિ સુકૃશતા ત્વયિ પરાત્મનિ સદ્ભાવે ॥ ૪ ॥

વસ્ત્રવિનાશે યથા શરીરે કસ્યાઽપિ ન વિનાશમિતિ ।

કર્મવિરચિતત્રિદેહનાશે નાસ્તિ તવાત્મનિ કા ચ ક્ષતિઃ ॥ ૫ ॥

માતા પિતા સખા મે સન્તિ ભિન્નશ્ચ નાસ્તિ મમ બન્ધુઃ ।

ત્યક્તવાચ્છિન્નમતિં ભાવય ત્વમહ સર્વદા સુખસિન્ધુઃ ॥ ૬ ॥

ભવતિ દુઃખાય વૈરાગ્યમબુદ્ધે: સુખાય સન્તિ વર વામા: ।

સતાં સર્વદા મુક્તિપ્રાદાતા પ્રાહ વૈરાગ્ય ઘનશ્યામઃ ॥ ૭ ॥

દશનદર્શનં જસ્યં પ્રાહુર્વસાકલુષતા નયનપ્રભા ।

માંસધન સુપયોધરમાહુનિશ્યસમા વનિતાપ્રભુતા ॥ ૮ ॥

ભુવિ યાનં યાનેઽસ્તિં શરીર તત્ત્ર ત્વં તિષ્ઠસિ ભવસ્વામી ।

મેઽસ્તિ શરીરં ને મેઽસ્તિ ભૂમિસ્ત્વ કુમતિ કથમનુગામી ॥ ૯ ॥

વિમચવિજ્ઞાનવિથેથરવ્યાપક સત્યબ્રહ્મસ્ત્વમસિ જ્ઞાતા ।

પ્રાહ મદાચસાઽલર્કસુતં પ્રતિશાસ્ત્રપ્રાસિદ્ધા વરમાતા ॥ ૧૦ ॥

લક્ષ્મી-રાધા જગન્માતા વિષ્ણુ-કૃષ્ણો જગત્પિતા ।

વંદે વૃંદાવને દેહે વેદવશીવિહારિણૌ ॥

# પ્રથમ પંક્તિની સૂચિ

[ક્રોંસમાં દર્શાવેલ હાલરડાંનાં શીર્ષક છે.]

અં અં કરે ને બાળો આંગળાં ધારે (જન્મોત્સવ)	256
એક દેવકી જશોદા બે બેનડી હરનું હાલરડું (જનેતાના હૈયામાં)	240
એક નાનું સરીખડું બાળ રે મા ! (આપણે આંગાડીએ)	241
ઓળોળો હાલ્ય વાલ્ય રે (પારણિયામાં પોઢ્યો)	258
જી, જી, હો-ઓ હો-ઓ (પારસી-ગુજરાતી હાલરડું)	267
જૂલ હાથીડા જૂલ (ખોળે જેલાવવાનાં જોડકણાં)	265
ડગમગ ! ડગમગ ! ડગલાં ભરતા હરજી મંદિર આવ્યા (થેઈ ! થેઈ !)	259
તમે મારાં દેવનાં દીધેલ છો (દેવનાં દીધેલાં)	242
તારે પારણે પોપટ બોલે છે (તારે પારણે)	257
ત્વમસિ તાત શુદ્ધબુદ્ધ નિરંજન... (મદાલસાનું હાલરડું)	270
થાંગનાં માંગનાં થૈ રે થૈ (થૈ થૈ પગલી)	266
દેવકીજીને શ્રીકૃષ્ણ જલમિયા ! (જુગના આધાર)	260
ધન્ય ગોકળિયું ધન્ય વનરાવન ધન્ય ગોકળની નારી ! (કાન્કંવરની જૂલડી)	264
ધૂંબડી સૈયરમાં રમે (સૈયરમાં રમે)	267
નવાનગરમાં નવલી વાત (કાનાની પછેડી)	264
નંદકિશોર રે નંદકિશોર (નંદકિશોર)	258
નિજ નિજ બાળા રે (નિજ નિજ બાળા રે)	269
નીંદરડી તું આવે જો આવે જો (નીંદરડી તું આવે જો)	246
પોઢો ને મારા હરિ હાલો હાલો (બહુ વા'લો)	243
બાબા તરે બારે હજારી આવ્યા સૂબેદાર (બેટા ! સો જાની !)	269
બાળકને હાલરડું વા'લું (હાલરડું વા'લું)	244
માતા અનસૂયા જુલાવે પૂતર પારણે રે ! (માતા અનસૂયા જુલાવે)	262
લાંઘું ને ગૂંઘું મારું આંગણું (ધોને રન્નાદ !)	239
સાવ રે સોનાનું મારું પારણિયું (બાળા, પોઢોને !)	245
સૂઈ જા રે સૂઈ જા ! (વીર ! સૂઈ જા)	246
સૂવો સૂવો બાવા રે ઘોઘર આવ્યા (ઘોઘર આવ્યા)	258
સોનલા ઠંઠોણી રે ભોળી જમના (ભોળી જમના)	263
હાલા રે હાલા, ભાઈને હાલા (હાલા રે હાલા)	255
હાલો રે વા'લો રે કાન કરસન કાળો (હાલો વા'લો રે)	247
હાલોને તો ગોરી, ભાઈને પારણે હીરની દોરી (હાલો ! હાલો !)	253
હાલ્ય વાલ્ય ને હાંસીનો (હાં આં...આં હાલાં)	249
હાં હીંચોળું ને હાં હાં કરું (પોઢોને !)	243